

# Gyan Amrit શાન્દામૃત

સુર  
દેવદીપાવલી

Vol.15 - Issue 11  
November 2022  
Price 12/-





વડोદરા અટલાદરામાં આયોજુત ‘ચૈતન્ય દેવીઓની ગંભી’ના ઉદ્ઘાટન બાદ સમુહિયિત્રમાં MSUના કુલપતિ ડૉ. વિજય શ્રીવાસ્તવ અને પરિવાર, સેનેટ મેન્ઝર ભાતા જુઝેશભાઈ, બ્ર.કુ. અનુભાબેન.



રાજકોટ અવધાપુરી ખાતે ‘કબિગુરુ સ્મૃતિ સંધી’ દ્વારા આયોજુત ‘દુગ્ધાપુલા’માં આંદ્યાભિક રહણ્ય સમજાસ્ત્વા બાદ સમુહિયિત્રમાં મહિલા કર્મિટીની ભરિનીઓ સાથે બ્ર.કુ. રેખાબેન, બ્ર.કુ. સંદ્યાબેન.



સુરત વરાણામાં નવરાત્રી મહોત્સવમાં ‘દેવીઓની ગંભી’નું ઉદ્ઘાટન કરતાં મધુબન સ્કુલના ટ્રસ્ટી ભાતા ગોપાલભાઈ, મ્યુનિસીપલ કોરપોરેટરો ભરિની રચનાબેન તથા સ્વાતીબેન, બ્ર.કુ. તૃપ્તિબેન.



પોરંદરમાં ‘દેવીઓની ગંભી’ના શુભારંભ બાદ સમુહિયિત્રમાં ગુજરાત નશાંબંધી વિભાગાના ડાયરેક્ટર ભરિની ડૉ. ચેતનાબેન, અગ્રણી મહિલાઓ પ્રજાબેન, ડૉ. રાજવીબેન સાથે બ્ર.કુ. ગીતાબેન.



બુજું-કર્ણ ખાતે ‘દેવીઓની ગંભી’ના દર્શનાર્થી પદ્ધારેલ કર્ણ જીલ્લા પંચાયત પ્રમુખ પારલાબેન, નગરપટી ભાતા ધાનશ્યામભાઈ, કર્ણમિત્ર સમાચારપત્રના તંત્રી દિપકભાઈ મંકડ, બ્ર.કુ. રક્ષાબેન.



રાજકોટ વિછીયામાં દશોરાના પર્વ વ્યસનમુક્તિનો સંદેશ આપ્યા બાદ બ્ર.કુ. રેખાબેન, બ્ર.કુ. ગીતાબેનનું સંન્માન કરતાં ગરણી મંડળના કાર્યકર્તાઓ.



વડનગર ખાતે નવરાત્રી મહોત્સવમાં આયોજુત ‘ચૈતન્ય નવ દેવીઓની ગંભી’નું મનોરમ દશ્ય.



રાજુલામાં નવરાત્રી ઉત્સવમાં ‘પંચદેવીઓની ચૈતન્ય ગંભી’નું ઉદ્ઘાટન કરતાં ધારાસંભ્ય અમરીષભાઈ ડેર, તાલુકા મેજુસ્ટ્રેટ ભાતા રાહુલભાઈ ચાવડા, બ્ર.કુ. અનુભાબેન.



# Gyan Amrit

## શાન્મુહી

વર્ષ ૧૫

નવેમ્બર - ૨૦૨૨

અંક : ૧૧

### પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયનું મુખ્યપત્ર આમૃતસૂચિ

● મૌન .....	તંત્રી સ્થાનેથી ..04
● અમૃતધારા .....	દાઈ જાનકીજી ..07
● ગતિ અને પ્રગતિ મંદ શા માટે? .....	બ્ર.કુ. જગદીશચંદ્ર ..09
● પ્રસંન્નતાના પથ પર .....	બ્ર.કુ. શિવાનીબેન ..11
● વિઘ્નોનું કારણ -સૂક્ષ્મ અપવિત્રતા .....	બ્ર.કુ. સૂર્યભાઈ ..15
● ફોલો ફાધરનો પુરુષાર્થ .....	બ્ર.કુ. ચંદ્રવદન ..19
● સ્નેહ, સાહસ અને રમણિકતાની .....	બ્ર.કુ. હેમંતભાઈ ..21
● દિવ્યદર્શન .....	બ્ર.કુ. નંદિનીબેન ..27
● વર્ષ 2023 માટે વિશેષ સૂચના .....	29
● પ્રસંગ પરિમલ .....	31
● માણસને ગ્રહો નથી નડતા, પૂર્વગ્રહો .....	રોહિત શાહ ..33
● સંગમયુગની શર્દાવલી .....	34

2023ના લવાજમના નવા દર

#### ભારતમાં

વાર્ષિક લવાજમ	રૂ. ૧૩૦.૦૦
આજુવન સભ્ય	રૂ. ૨,૨૦૦.૦૦
છૂટક નકલ	રૂ. ૧૫.૦૦

#### વિદેશમાં

એર્બેર્ડ્લ વાર્ષિક	રૂ. ૧,૬૦૦.૦૦
આજુવન સભ્ય	રૂ. ૧૨,૦૦૦.૦૦

કૃતિઓ તથા સેવા સમાચાર

મોકલવાનું સરનામું

બ્ર.કુ. ડૉ. કાલિદાસ પ્રજાપતિ

તંત્રી : જ્ઞાનમૃત

જુ-૨/૨૨, શિવમ એપાર્ટમેન્ટ,  
નવા વાડ્જ, અમદાવાદ - ૩૮૦ ૦૧૩.

Phone : 99798 99104

#### મુદ્રક અને પ્રકાશક રાજ્યોગિની ભારતીદીદી

-:- વિશેષ સૂચના -:-

જ્ઞાનમૃતનું નવું વર્ષ

જાન્યુઆરી 2023 થી શરૂ થનાર છે.  
સર્વ ગ્રાહકો અને પ્રિય વાંચકોને  
જણાવવાનું કે, આપને સભ્ય બનવા  
તથા અંક મેળવવા માટે તાત્કાલિક  
તા. 30-11-2022 પહેલા આપનું નામ  
નજીકના સેન્ટર પર નોંધાવી  
સાથ-સહકાર-સહયોગ આપશો.

#### આવશ્યક નોંધ

### પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય

Account No. : 03290100041261 IFSC Code : BARB0GITAMA

Bank Name : BANK OF BARODA, Geeta Mandir Branch

પ્રકાશન સ્થળ - ગુજરાત ઝોન મુખ્યાલય

બ્રહ્માકુમારીઝ, સુખશાંતિ ભવન, ભુલાભાઈ પાર્ક રોડ, કાંકરિયા, અમદાવાદ - ૩૮૦ ૦૨૨.

Phone: 079 - 2532 4460

Email : gyanamrit.guj@gmail.com

## મૌન

### મૌન શું છે ?

આધ્યાત્મિક માર્ગ ચાલનારને મૌન વિશે કહેવાનું ના હોય. સૌ સાધકોએ મૌનની અનુભૂતિ કરેલી જ હોય છે. ગુજરાતના જાણીતા સંત પૂ. મોટાએ નડિયાદમાં હરિ ઓમ આશ્રમ દ્વારા મૌનમંદિરની સ્થાપના કરી છે. જે આજે પણ ચાલુ છે. તેનો લાભ લેનાર સાધકો સંતુષ્ટ પ્રસંન થયા છે, દિવ્યતાની પ્રાપ્તિનો અનુભવ કરેલો છે.

બ્રહ્માકુમારીજ સંસ્થામાં ચૌદ વર્ષ સુધી સાધનાની ગણનતામાં જવાનું જે તપ કરાયું હતું. તેમાં પણ મૌનને વિશેષ મહત્વ અપાયું હતું. વર્તમાન સમયે પણ કેટલાક રાજ્યોગીઓ સપ્તાહમાં એક દિવસનું મૌન પાળે છે. જ્ઞાનયોગના વિશેષ વર્ગો (ભૃણી)ના સમયે પણ મૌન વિશે કહેવામાં આવે છે.

**મૌનને સંક્ષિપ્તમાં સમજાવવામાં આવે, તો કહી શકાય કે તે આત્માનું અંતર્દર છે. આત્માનું ઓજસ છે. બહિર્મુખતાને વિદાય આપી, અંતર્મુખતાને આવકારવાનું પર્વ છે. લોકો કહે છે, ‘ન બોલવામાં નવગુણા’, મૌન એટલે હળવા રહેવું, અશારીરી, વિદેહી બનવું. સંત યોગેશ્વરજી સ્થાપિત સ્વર્ગરોહણ, અંબાજીનાં અધિષ્ઠાત્રી સર્વેશ્વરી મા ઘણાં વર્ષોથી મૌન પાળે છે. મૌને એમના વ્યક્તિત્વને દિવ્ય બનાવ્યું છે.**

### મૌનના પ્રકાર

મૌન તો ઘણા સાધકો પાળે છે પણ તેની ગણનતામાં જઈને ચિંતન કરવું અતિ આવશ્યક છે. મૌનના બે પ્રકાર છે.

### ૧. સ્થૂળ રૂપે વાણીને વિરામ આપવો.

માઝ મુખને બંધ રાખી, વાણીને વિરામ આપવો એજ મૌન નથી. આ તો તેની સ્થૂળ ઓળખ છે. યોગ્યતા વિનાના સાધકો વાણીના મૌનથી આગળ ના વદે, તો તેની દિવ્યતાનો અનુભવ ના કરી શકે. મૌન અકળાવવાનું માદ્યમ નથી. જબરદસ્તીનો સોદો નથી. અંતરમનમાં મૌન માટે અહોભાવ જાગે, તે માટેની માનસિક સજ્જતા હોય તે જરૂરી છે. મૌનને પ્રસંનાતાથી અપનાવવામાં જ મજા છે.

### ૨. સૂક્ષ્મ રૂપે મનનું મૌન રાખવું.

માનવ ચૈતન્ય પ્રાણી છે. તેનામાં આત્મા ધબકતો રહે ત્યાં સુધી મન તો ચાલવાનું જ છે. મન, બુદ્ધિ, સંસ્કાર સહિતની ચૈતન્યસત્તા આત્માનું પ્રથમ અંગ મન ચંચળ છે. રાજ્યોગી જીવનના નિયમો પવિત્રતા, દિવ્યગુણોની ધારણા, સાત્ત્વિક આહાર અને દરરોજનો સત્સંગ કરવા છતાં પણ જ્યારે મનમાં વ્યર્થ સંકલ્પો ચાલે, પરચિંતન, પરદોષ દર્શન ચાલે, જ્ઞાનમાર્ગ પણ ભક્તિમાર્ગના જેવો કર્મકાંડી બની જાય ત્યારે સૂક્ષ્મ મૌનથી ચિંતન કરવાની જરૂર છે.

જીવન પ્રબંધન વિશેષજ્ઞ રાજ્યોગિની બ્રહ્માકુમારી શિવાનીબહેન કહે છે કે ‘આપણે મનને વિચારવાનું બંધ કરાવી શકતા નથી. પણ મનને શ્રેષ્ઠ, શુભ, કલ્યાણકારી, પ્રભુચિંતનના વિચારો આપી તેને યોગ્ય રાહ આપી શકીએ છીએ.’ બાબાએ તેથી જ ‘મનમનાભવ’નો મંત્ર આપ્યો છે. આમ મન યથાર્થ રીતે કામ કરે તેને જ મનનું મૌન કહેવામાં આવે છે. જે સર્વ

## કર્મન્દ્રિયોનો કન્ટ્રોલ કરે છે.

### મૌનથી થનારી પ્રાપ્તિ

મૌનનું આટલું મહિત્વ કેમ છે ? કારણ કે તેનાથી થનારી પ્રાપ્તિઓ અદ્ભુત છે. મૌન આત્માનો પરમાત્મા સાથે બુદ્ધિયોગ જોડવાનું અસરકારક માધ્યમ છે. તેનાથી એકાંતમાં રહી, એકાગ્રતા કેળવી અતીન્દ્રિય સુખની પ્રાપ્તિ સ્વાભાવિક બને છે. અંતરમનની દુનિયામાં ડોક્ફિયું કરવાની તક મળે છે. મીઠા બાબાએ કહેલું છે કે મધુવન શીશમહેલ બનશે. તેમાં સાધકની આંતરિક અવસ્થાની તરસીર જોવા મળશે. તેથી મૌન એ અનુભવનાં રત્નો મેળવવા માટે રત્નાગઢે કરેલી યોજના છે. આ એવું અમૂલ્ય, અવર્ણનીય માધ્યમ છે. જેનો મોટા ભાગની આદ્યાત્મિક પ્રતિભાઓએ ઉપયોગ કર્યો છે. લોકો શિયાળામાં શક્તિ સંચય માટે ભિન્ન ભિન્ન પાકો આરોગે છે. આમ સાધક માટે મૌન એટલે શક્તિ સંચયનો શિયાળો. તે આંતરિક ખુશીનું માધ્યમ છે. ધણાં વર્ષોથી આપણે બ્રહ્માવત્સ બનીને જ્ઞાનમાં ચાલીએ છીએ. પણ મૌનથી મીઠા બાબા, યજા, શ્રીમતનું યથાર્થ મૂલ્ય અંકવાની અણમોલ તક મળે છે. તે સાધનાની સીડી કેટલી ચટ્ટાયા તેનું મૂલ્યાંકન કરવાનું પર્વ છે. તે વળી ઉપરામ, નાટોમોહા, સાક્ષીદૃષ્ટા બનવાની કસરત છે.

મૌન મનને સ્વસ્થ, પ્રસન્ન, તંદુરસ્ત અને શક્તિશાળી બનાવવાની લોટરી છે. તેનાથી મહિસાગરના તળિયે જઈ અમૂલ્ય રત્નો મેળવનારા મરજુવા કાર્યની અનુભૂતિ થાય છે. રોકિંદા જીવનમાં સત્તા, સમૃદ્ધિના નશાને ભૂલતાં તકલીફ પડે છે. પણ મૌનમાં અહંને ઓગળીને સત્તા, ધનના નશાનું નિયમન કરવાની તક મળે છે. મૌન એ વ્યર્થને વિદાય આપવાની અને સત્ય, સમર્થનો સંગાથ કરવાની તક છે. મોટી

મોટી પદવીઓ માટે અભ્યાસ કરતા, મહિત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવતા સાધકોને મૌનને સ્મૃતિશક્તિને શક્તિશાળી બનાવવાનો અવસર છે. **મુરલીમંથનની રુહાની મહેસુલ માણવા માટેની આ પણો છે.**

મૌનની શક્તિથી અસંભવને પણ સંભવ બનાવી શકાય તે માટે નિર્ણયશક્તિની ગણનતામાં જઈ શકાય છે. વળી આ **સ્વરાજ્ય અધિકારી બનવાનો ઉત્સવ છે.** બાબાની સાથે અતિ નિકટતા કેળવી પ્રભુપ્રિય બનવાનું વરદાન છે. મૌન એ તન, મનને શીતળ બનાવનાર એ.સી. છે. આ આવશ્યકતાઓને ઓગળવાની, ઘટાડવાની ભષી છે. શક્તિઓ, ગુણો, વિશેષતાઓના સંવર્ધનની પ્રયોગશાળા છે.

અતિ આવશ્યકતા વખતે ટૂંકાવાક્યોના પ્રયોગથી મૌનનું મહિત્વ ઘટતું નથી. દરેક વાતમાં વિવેકશક્તિની ધણી જરૂર છે. આપણે એવી આવશ્યક જવાબદારીઓ સાથે સંકળાયેલા હોઇએ તો તેમાં માપસરનું મૌન કામમાં આવી શકે. **મૌન એ અંતરમનની ચાત્રા છે.** તેનાથી પરિવારમાં અશાંતિ ના વધે, જ્ઞાન માટેના અભિપ્રાયો બદલાય નહીં તે માટે જડતા નહીં પણ વ્યવહારું ઉકેલ જરૂરી છે. તેમાં પરિવારના પ્રેમપૂર્ણ સહયોગની જરૂર છે.

પરિવારના સંબંધોમાં સંદર્ભ થાય ત્યારે એક પક્ષ બોલે, તો બીજો પક્ષ મૌન રહે. સહનશીલતા, સમાવવાની શક્તિ અને મૌનથી કલેશ, કંકાસને આગળ વધતા અટકાવી શકાય. **સ્વાસ્થ્ય સાચયવા માટે કહેવાયું છે કે કમ ખાાં અર્થાત્ ચૂપ રહો, મૌનમાં રહો.** મીઠા બાબાએ માફકસરના મૌનની કેટલી સુંદર વાત કહી છે. કમ બોલો, ધીરા બોલો, મીઠા બોલો.

શાંતિવન, આબુરોડમાં અવ્યક્ત બાપદાદાના મિલન વખતે દેશ વિદેશોના પચીસ હજાર કરતાંથે વધારે બ્લાબલ્ટ્સો આવે છે. ડાયમંડ છોલમાં બેસીને કલાકો સુધી મૌનમાં રહીને યોગાભ્યાસ કરે છે ત્યારે શાંતિનું દૃશ્ય કેટલું આકર્ષક લાગે છે. કારણ કે આ સ્વની પ્રસંગતાથી સ્વીકારેલું મૌન છે. કોઈનું લાદેલું નથી.

સતત જગૃતિ, સજ્જતા, દેહી અભિમાની બનવા મૌનનો અભ્યાસ વરદાન બની જાય છે. મૌન આત્માનું અનુશાસન શીખવે છે. વ્યર્થને આગળ વધતાં અટકાવે છે. મૌન ચિંતનથી તેને બ્રેક વાગી જાય છે. મૌન એ ઉર્જા બચાવનાર શક્તિશાળી માદ્યમ છે. તેનાથી સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને બોલવામાં સભાનતા વધે છે. કોઈએ કોઈ પ્રજ્ઞનો વરિત ઉત્તર આપવાનું કહ્યું હોય ત્યારે એક વાક્ય બોલીએ, વિચારીને કહીશ, ઘરમાં પૂછી જોઈશ. પછી મૌન થઈ જઈએ. આમ વરિત ઉત્તરના કારણે કચારેક સમસ્યાઓ સર્જય છે તે ટાળી શકાય. મૌનનો વિષય અનુભવનો છે. મૌનના સધન અનુભવથી સંપન્ન બનો એ જ શુભભાવના, શુભ કામના.

॥ ઊં શાંતિ ॥

- બ્ર.કુ. કાલિદાસ

- ફળ આવતા વૃક્ષ નમે છે, વર્ષા વખતે વાદળ નમે છે, સંપત્તિમાં સજ્જન નમે છે. પરોપકારીઓનો સ્વભાવ જ સેવો હોય છે.
- મનને હર્ષથી ઉલ્લાસવાળું બનાવશો તો હજારો તુકસાનમાંથી બચી જશો અને લાંબુ જીવશો.
- મૌન સર્વોત્તમ ભાષણ છે જો બોલવું પડે તો ઓછામાં ઓછું બોલો જ્યાં એક શબ્દથી કામ ચાલે ત્યાં બે ન બોલો.

(પેજ નં. 10નું અનુસંધાન).... ગતિ અને પ્રગતિ પાસેથી આપણને કોઈ સારી વાત સાંભળવા અને સમજવા મળે તો આપણે અભિમાનમાં આવીને યા ગમે તેવું અર્થધટન કરીને એનો તિરસ્કાર ન કરીએ પણ એ જગ્યાવનારનો હાઈક આભાર માનતાં કહેવું જોઈએ કે અમે એ વાત ઉપર દ્યાન આપીશું અને ખરેખર એ વાતો ઉપર દ્યાન આપીએ. બીજો રસ્તો એ છે કે જો કોઈ આપણને મૌખિક રીતે કોઈ એવું જ્ઞાનમોતી યા ગુણ રલ્ન ન આપે તો પણ આપણે વ્યવહારમાં દરેક પાસેથી ગુણ લઈએ અને એના ગુણની ચર્ચા પણ કરીએ. જો આપણે ગુણ નહીં લઈશું તો અવગુણ લઈશું અને એનાથી તો પતન થશે. પ્રગતિ તો થશે નહીં. કોઈના અવગુણ જોવાથી આપણે ખરાબ શીખીશું એનાથી પુરુષાર્થની ગાડી આગળ વધવાને બદલે પાછળ જ પડશે.

### ટાળવાની આદત


આપણી પ્રગતિ ન થવાનું એક કારણ એ પણ છે કે આપણે એ માનીને ચાલીએ છીએ કે આગળ જતાં આપણા સંસ્કારોને બદલીશું. પરિસ્થિતિઓ જ એવી આવશે કે બધા બદલાશે. ત્યારે આપણે પણ બદલાઈ જઈશું. કેટલાક સમય પછી, જ્યારે અમારી આ પરિસ્થિતિ બદલાઈ જશે ત્યારે અમે ખૂબ યોગ કરીશું. અમે એવો તીવ્ર પુરુષાર્થ કરીશું કે બધાં જોતા જ રહી જશે. આ પ્રકારના વિચારથી મનુષ્ય પુરુષાર્થને સ્થગિત અથવા મુલતવી રાખે છે અને પરિણામ એ આવે છે કે સમય હાથમાંથી ચાલ્યો જાય છે. તેથી સમય ચાલ્યો ન જાય તે વાત ઉપર દ્યાન આપવાની જરૂર છે. જે કરવાનું છે તેને ટાળીએ નહીં નહીંતર આળસ અને અલબેલાપણું ઘણું નુકસાનકારક છે. જો આપણે આ વાતો ઉપર દ્યાન આપીશું, તો પરમપિતા પરમાત્મા સાથે આપણું ‘દ્યાન’ લાગશે.

॥ ઓમશાંતિ ॥

## અમૃતધારા

# સહનશીલ, શીતલ અને સંતુષ્ટ રહેનારા સદા સુખી રહે છે.

રાજ્યોગિની દાદી જનકીજી, પૂર્વ મુખ્ય પ્રશાસિકા, શાંતિવન, આબુરોડ



જેણે પવિત્રતાનું મૂલ્ય સમજુ લીધું છે, તેના જીવનમાં અપવિત્રતાનું નામનિશાન રહેતું નથી. શુદ્ધ, પવિત્ર બ્રહ્મએ (બ્રહ્માવત્સ) બનતાં જ શુદ્ધ આહાર, શુદ્ધ વિચાર, શુદ્ધ વ્યવહાર બની જાય છે. પવિત્રતાની ધારણા માટે જ શુદ્ધ આહારી બનો. જો જીવનમાં શુદ્ધ વિચારો છે, તો શુદ્ધ વ્યવહાર છે. બ્રહ્માવત્સોનો વ્યવહાર રૂહાનિયતપૂર્ણ, નિઃસ્વાર્થભાવવાળો છે. એક જ પર્ચિવાર છે. એક જ માતપિતાનાં બાળકો છીએ. એક જ પાઠશાળામાં ભણી રહ્યા છીએ. ભણાવનાર પણ એક જ શિક્ષક છે. એક જ સતગુરુની શ્રીમત ઉપર ચાલીએ છીએ ત્યારે તો પાવન બનીએ છીએ.

પહેલાં શુદ્ધ બનવાનું છે. શુદ્ધતા આકર્ષિત કરે છે. તન મનને સ્વર્ણ બનાવવા માટે સફાઈ જોઈએ, શુદ્ધિ જોઈએ. એટલા માટે અન્નનું, સંગનું દ્યાન રાખવાનું છે. જેવો સંગ છે તેવો રંગ છે. જેવું અન્ન છે તેવું મન છે. બ્રહ્માવત્સોએ સમજુ લીધું છે તેથી તો સત્ત બાપના સંગમાં રહે છે. આપ સૌ જ્યારથી બાબાનાં બન્યાં છો ત્યારથી શુદ્ધ આહાર, શુદ્ધ વિચારવાળા છો. પ્રવૃત્તિમાં રહેવા છતાં પવિત્રતાનું પાલન કરી કમલપુષ્પ સમાન રહે વાથી, ન્યારા રહે વાથી, બાબાનો (પરમાત્માનો) પ્રેમ મેળવવા માટે અધિકારી બનો છો. બાબાના બનતાં જ જેનાં આહાર, વિચાર, વ્યવહાર શુદ્ધ બને છે તો તેની જીવનનેચા પાર થઈ જાય છે.

આજકાલ બાપદાદા (અવ્યક્ત પ્રભાપિતા બ્રહ્મા અને નિરાકાર પરમપિતા શિવ પરમાત્મા)ની દૃષ્ટિથી જ અનેકોને આંતરિક સુખનો અનુભવ થાય છે. બાબાના બોલને કદી ભૂલી શકતા નથી. બાબા જે કહે છે તે વાત સૌના દિલને સ્પર્શી જાય છે. દૃષ્ટિથી બાબાને પોતાના બનાવી દીધા. અર્થાત દિલથી બનાવ્યા. કારણ કે કેટલાય એવા આત્માઓ છે કે જેઓ ભાષા સમજતા નથી. દિલ દૃષ્ટિ દ્વારા પ્રત્યક્ષ થઈ જાય છે. એટલે બાબાએ કહ્યું પવિત્રતા, સત્યતાને સિદ્ધ કરે છે. આ બે વાતોએ આપણી લાઈફ (જીવન) લાઈટ (હળવી) બનાવી દીધી. વાસ્તવિક રીતે લોકો સમક્ષ પ્રભાવ પડયો છે. જે આપણે પહેલાં આચરણમાં મૂકીએ છીએ, તે જ કહીએ છીએ.

બાબાએ બ્રહ્મામુખથી જ્ઞાન આયું. બ્રહ્મા બોજન ખવડાયું. સત્યજ્ઞાન આપીને સાચી સત્ય નારાયણની કથા સંભળાવીને નિશ્ચયના બળથી, નિઃસ્વાર્થ ભાવથી, નિશ્ચિંત રહેવાની રાખાઈ આપી છે. નિઃસ્વાર્થ ભાવથી નિષ્ઠામ સેવાધારી બની રહો. સત્યતા અંદર છે. પવિત્રતા ધારણામાં છે, નમૃતા વ્યવહારમાં છે. સત્યતાને મુખથી સિદ્ધ કરવાની જરૂર નથી. અંદર અભિમાનનો અંશ ના રહે. આપણે સાચા છીએ એ કહેવાની જરૂર નથી. પણ સત્ય આજ છે. પોતાની મેળે આપ આત્માઓનો અંદરથી અવાજ નીકળે, ખભો હલે અને ચૂપચાપ સાંભળી રહે, કારણ કે બુદ્ધિવાનોની બુદ્ધિ બાબા છે. દિવ્યબુદ્ધિ દાતા છે. સાક્ષી બનીને જોઈશું તો એ અનુભવ થશે કે પવિત્રતા, સત્યતા અને નમૃતાથી આપણી દૃષ્ટિમાં કેટલું પરિવર્તન આયું છે. એક દેછી અભિમાની

સ્થિતિ પોતાના દેહમાં હોવા છતાં સંબંધોથી મુક્ત રાખે છે. દેહની સાથે સંબંધ રાખનારી અનેક વાતો ભૂતકાળ બની ચૂકી છે. તે આકર્ષિત કરી શકતી નથી.

મીઠા બાબાની બાળકો માટે સારી કામના પણ છે, ભાવના પણ છે કે મારાં બાળકો સંપન્ન બને. નિર્વિકારી તો છે પણ સંપન્ન બને. આપણાને બાબાએ જ્ઞાનરત્નોનો ઘણો ખજનો આપ્યો છે, પવિત્રતા ખજનાને સંપન્ન બનાવવામાં મદદ કરે છે. ઈશ્વરીય બોલનું ઉચ્ચારણ કરતા નથી પણ પોતાનો પ્રભાવ પાડવાના બોલ છે તો તેને પણ અશુદ્ધ વાણી જ કહીશું. આપણા ઉપર કોઈનો પ્રભાવ પણ ના પડે, આપણે કોઈના ઉપર પ્રભાવ ના પાડીએ ત્યારે કહીશું શુદ્ધ વાણી, આપણે તપાસીએ કે પ્રારા ભોગાનાથ વરદાતા બાબાના બોલ મારા ઉપર અસર કરી રહ્યા છે. એટલે મમ્માને (જગંબા સરસ્વતી) વીણા આપી, બાબાને મુરલી (ઇશ્વરીય મહાવાક્યો) આપી. મમ્માએ બાબાની વાણી સાંભળી અને તેને યથાર્થ સ્વરૂપે ઉચ્ચારી. ગહનતામાં જઈને પોતાના જીવનમાં ઊતારીને આ મહાવાક્યોથી અમારી પાલના પણ કરી છે. તો માત-પિતા (માતેશ્વરી જગંબા સરસ્વતી અને પિતાશ્રી પ્રભાપિતા બ્રહ્મા)એ અમારી પાલના કરી છે, ભણાવ્યાં છે અને દરેક વાતોમાંથી પાર લઈ જવા માટે સરસ તાલીમ પણ આપી છે. પળમાં હંદોથી પાર થઈ જાઓ. દ્રામા કહેવાની પણ જરૂર નથી. ખબર છે કે જે થવાનું હતું તે થઈ ગયું. આટલો મમ્માએ દ્રામાનો પાઠ પાક્કો કરાવ્યો છે.

આપણે આગળ વધી રહ્યાં છીએ. કંઈ મારું નથી અને હું આત્મા કોઈનો નથી. જેથી કંઈ થોભી જવાનો પ્રશ્ન નથી. જેઓ સમજે છે કે મારું કંઈક છે, તો તેઓ તેને પકડીને બેઠાં છે. ના આપણે પકડીને બેઠાં છીએ, ના સૃષ્ટિનો કોઈ પદાર્થ

આપણાને પકડી શકે. એટલે રીયલ યોગી છીએ. કોઈ કામના નથી પણ સૌના માટે સાચી ભાવના છે. કોઈની પાસેથી કંઈ જોઈએ નહીં. મીઠા બાબાએ આપણાને સંકેત આપ્યો છે ઈચ્છા માત્રમાં અવિદ્યા. એમાં સારી રીતે પાસ થઈ જાઓ. તો સ્વયંને પૂછો કોઈ ઈચ્છા છે? ઈચ્છા છે તો આંખ તે તરફ જાય છે. કંઈક ઈચ્છાએ છીએ અને તે મળતું નથી તેથી અસંતુષ્ટતા થાય છે. સ્થિતિને ઊંચી બનાવવા માટે જો આપણામાં સહનશીલતા છે, તો કોઈ પ્રશ્ન નથી. કોઈએ કંઈક કહ્યું, કર્યું, સમાવી દીધું, સમેટી દીધું, તેમાં શી મોટી વાત છે? સહનશીલતા ઘણા શીતળયોગી બનાવી દે છે. એનો જો થોડો પણ અભાવ હશે, તો ચલન અને ચહેરો બદલાઈ જશે. પછી અવાજ બદલાઈ જાય છે અને સંબંધમાં શુષ્કતા આવે છે, આ શોભતું નથી. વાસ્તવમાં આ સહનશીલતાનો અભાવ છે. મોટી વાત નથી પણ સર્વગુણોમાં સંપન્ન બનવાનું છે. તો એક ગુણમાં પણ જો થોડી પણ ખામી હશે, તો તે કદી આપણા પદને નીચું લાવી શકે છે, ઊંચ પદ મેળવવા દેતી નથી. ઊંચી સ્થિતિમાં રહેવા દેતી નથી.

સ્વરાજ્ય અધિકારી કદી સંતુષ્ટ ના રહે આ કઈ રીતે બની શકે? હું કોણ છું? કોનો છું? મને ભગવાન પાસેથી કેટલું બધું મળ્યું છે? શું બ્રાહ્મણોના ખજનામાં કોઈ અભાવ છે? છતાં પણ જો સંતુષ્ટ ના રહે, તે તેને શું કહી શકાય? તમે જ વિચારો અને આપણાને જોઈએ શું? એ સારું છે કે બાબાએ આપણાને સફેદ કપડાં પહેરાવી દીધાં. સફેદ રાખવાનું શીખવ્યું છે. સર્વાઈથી ચાલવાનું છે, સાદગીમાં રહેવાનું છે. અસંતુષ્ટ રહેવાની કોઈ વાત જ નથી. તો એક પણ ગુણનો અભાવ સંગમમાં આપણાને શ્રેષ્ઠ બ્રહ્માવત્સ બનવા નહીં દે તો કદી અસંતુષ્ટ ના રહો. સર્વ કાંઈ છે એમ સમજો, તો તમે સંતુષ્ટ છો, ખરેખર સૌ સંતુષ્ટ છો. (અનુસંધાન પેજ નં. 28 પર)

# ગતિ અને પ્રગતિ મંદ શા માટે?

બ્ર.કુ. જગદીશચંદ્ર, દિલ્હી



જુવન એક યાત્રા છે. દરેકે પોતાની મંજિલે પહોંચવાનું દયાન તો અવશ્ય રાખવું જ જોઈએ. બીજી રીતે કહીએ તો એમ કહી શકીએ કે દરેકે પોતાના લક્ષ્ય સુદી પહોંચવા માટે તદ્દાનુસાર લક્ષ્યાના તો ધારણ કરવાં જ જોઈએ અથવા વાંછિત સિદ્ધિ પ્રાપ્ત કરવા યા સિદ્ધિ સ્વરૂપ બનવા માટે દરેકે સાધના તો કરવી જ જોઈએ.

જ્યારે માનવે સંસારની અગણિત પ્રાપ્તિઓને ઠોકર મારીને યોગી જ બનવાનું વ્રત લીધું હોય તો એણે યોગની સૂક્ષ્મતા, ગહનતા, ઊંચાઈ યા સિદ્ધિ સુદી પહોંચવાનો પૂરો પુરુષાર્થ તો કરવો જ જોઈએ. (દેછ અભિમાનથી) અડધા મરીને કામ કરવાથી શો લાભ ? જો જુવનમાં ઉત્સાહ અને ઉમંગ ના રહે તો એક કિલો વજન પણ એક કિવંટલ લાગે છે, તેથી પરિસ્થિતિઓની સામે લડવામાં જ વીરતા છે અને કમર કસીને કામ કરવામાં જ સફળતા છે.

યોગાથી થનારા ફાયદાઓની જો ચાદી બનાવવા ઈરછીએ તો તે બનાવવી શક્ય નથી. એના બદલે ‘યોગી જુવનથી પ્રાપ્ત ન થાય એવી કોઈ શ્રેષ્ઠ પ્રાપ્તિ જ નથી.’ એમ કેમ ના કહીએ. જે પ્રારંધ બને છે તે તો અનુપમ છે જ પરંતુ વર્તમાનમાં યોગની સ્થિતિથી જે પ્રાપ્તિઓ થાય છે તે અવર્ણનીય છે.

## ગતિ મંદ શા માટે ?

પરંતુ આ સર્વ જાળવા છતાં પણ યોગી પોતાના પથ ઉપર ચાલતાં ચાલતાં સ્વયં પ્રગતિ

કેમ કરી શકતો નથી ? એની ગતિ મંદ શા માટે થઈ જાય છે ? અપાર પ્રાપ્તિના માર્ગથી વિમુખ થઈને તે શા માટે અટકી જાય છે ? તે ક્યારેક ક્યારેક કેમ પાછો પડે છે? યોગી જુવનનો જે શ્રેષ્ઠ અને રસીલો અનુભવ છે એનો અભાવ કેમ અનુભવે છે? પ્રભુ તરફ આગળ વધતાં વધતાં તેનો માર્ગ કેમ ભૂલી જાય છે ? તેનાથી તો ઘણું નુકસાન થાય છે. પુરુષાર્થી પોતાની મંદગતિનાં કારણો જ જણાવ્યા કરે છે. પોતાની પ્રગતિ ધીમી થવાનું સ્પષ્ટીકરણ જ આપ્યા કરે છે પરંતુ એનાથી એવું અપાર નુકસાન થાય છે કે પસ્તાવો કરવાથી ભરપાઈ કરી શકતું નથી. લોકો યોગીને ચ્યામ, નિયમ... અને પ્રત્યાહાર, ધારણા, દ્યાન, સમાધિનો અભ્યાસ કરવાનું કહે છે અને યોગી પણ મનમાં પરમપિતા પરમાત્માનું ‘દ્યાન’ કરવા તથા ચ્યમ-નિયમોનું પાલન કરવાનો પુરુષાર્થ કરવાનું દ્યાન રાખે છે. પરંતુ બે-અણ વાતોનું દ્યાન ન રાખવાથી ધીરે ધીરે ચ્યમ-નિયમ ઢીલાં પડવા લાગે છે અને પરમપિતા પરમાત્મામાં પણ દ્યાન લાગતું નથી. તેથી મનમાં પરમાત્માનું ‘દ્યાન’ કરવાની સાથે સાથે બે-અણ મહિંદ્રપૂર્ણ વાતો તરફ દ્યાન આપવું પણ જરૂરી છે. તે વિના સ્થિતિ પરિપક્વ બની શકતી નથી.

કોઈએ કહું છે ‘આચા કુતા ખા ગયા તૂ બેઠી ઢોલ બજા.’ એક માતા પોતાની પડોસણો સાથે ઢોલ વગાડીને કીર્તન કરીને શાંતિ મેળવવાના પ્રયત્નમાં વ્યસ્ત હતી. એનું દ્યાન ચૂકાવીને કૂતરું એની બદી રોટલીએ ખાઈ ગયું. આ પ્રમાણે મનુષ્ય તો ટેપ રેકોર્ડર અને કેસેટ રૂપી આધુનિક ઢોલ પર ગીત વગાડીને પરમાત્માનું દ્યાન કરવાનો પ્રયત્ન કરી રહે છે પરંતુ વ્યર્થ

સંકલ્પરૂપી ‘કૂતરું’ આવીને એની બનાવેલી ધારણાને નષ્ટ કરી દે છે તેથી મનુષ્ય જે રીતે પરમપિતા પરમાત્માનું દ્વાન કરે છે. તેની સાથે તત્ત્વસંબંધી જરૂરી વાતો પર દ્વાન આપે તે જરૂરી છે. માત્ર યોગાભ્યાસી જ ન બને પણ ‘યોગીજીવન’ વાળો પણ હોય. એટલે નીચે જણાવેલી બે-ત્રણ વાતો પર દ્વાન આપવું જરૂરી છે.

### શીખવાની પ્રવૃત્તિ અને નમ્રતા

દીરે દીરે શીખવાની પ્રવૃત્તિ મંદ પડી જવી તે આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ અટકી જવાનું એક ધારું મોકું કારણ છે. જ્યારે વ્યક્તિ યોગી જીવનના પથ ઉપર પગ મૂકે છે ત્વારે પ્રારંભમાં તો ધૂન લાગે છે. જીવનને બદલી દેવા માટે તે ઉત્સાહી બને છે. યોગના ઉત્ત્ય શિખર પર ચાટી જવું છે તેવો સંકલ્પ સમર્થ બની જાય છે. પરંતુ જ્યારે તે કંઈક શીખી જાય છે, અન્ય લોકો કરતાં થોડો આગળ વધી જાય છે ચા એને યોગના સારા અનુભવ થવા લાગે છે ત્વારે તે સ્વયંને અનુભવી ચા યોગમાં શિક્ષિત સમજુને ચાલવા લાગે છે. વધુ શીખવા માટે એની પહેલા જેવી રૂચિ રહેતી નથી. એનું એક કારણ એ પણ હોય છે કે તે બીજા યોગાભ્યાસીઓમાં કોઈ વિશેષતા જોતો નથી. પણ એમને તે કચાંચ ને કચાંચ અટકેલા જુએ છે ચા તે પોતાને સમજદાર સમજુને બીજાઓ સાથે યોગ ચર્ચા કરવામાં, અનુભવની લેણ દેણ કરવામાં, એમની પાસેથી પોતાની પ્રગતિ માટે કંઈક પ્રકાશ મેળવવાની દીર્ઘા રાખતો નથી. સૂક્ષ્મરૂપમાં એનામાં અહુંકાર આવે છે જેની એને પણ ખબર પડતી નથી. હવે આ શરીર છૂટી જાય, તો પોતાની શી ગતિ થશે એ પણ તે વિચારતો નથી. શા માટે કોઈ વરિષ્ઠ યોગીઓ પાસેથી કંઈક વધુ વધુ ન શીખીએ ? જીવનના કાર્યક્રમમાં તે પણ કાર્યકુશળ હોવાથી સ્વયંને સર્વ પ્રકારે કુશળ જ માનવા લાગે છે. અને પોતાની ખામીઓને છૂપાવીને, દબાવીને ચા એમ

જ એકબાજુ રાખી દે છે. તે વિચારે છે કે ‘ખામીઓ તો સર્વમાં છે.’ આ પ્રમાણે સ્વયંને ‘તીસ માર ખાન’ સમજુને તે એટલો તો ગર્વના કળણમાં ખૂંપી જાય છે કે જો કોઈ એનું ભલું દર્શાવે એને દલદલમાંથી કાઢવા દરછે પણ તે એને પોતાનાથી ઓછી કક્ષાનો ચા સમાન કક્ષાનો સમજુને એની શુભભાવનાઓને ઠોકર મારે છે. પરિણામ એ આવે છે કે તેનાથી વરિષ્ઠ હોય તે પણ તેના કલ્યાણની વાત કરતાં સંકોચ પામે છે અને જો કોઈ કહે તો તે તેને ‘હસ્તક્ષેપ’, ‘અનાદિકાર ચેષ્ઠા’, ‘અનુચિત’, ચા ‘નકામી વાત’ માને છે. તે તો સમજે છે કે આ વાતની તો મને પણ જાણ છે. આ કચાં કોઈ નવી વાત છે ! અથવા ‘આ નબળાઈ તો સર્વમાં છે, માત્ર મારામાં જ થોડી છે’, ચા ‘માત્ર મને જ આ ઉપદેશ શા માટે આપવામાં આવે છે. મને સમજાવનાર પહેલાં પોતાની ભૂલ તો સુધારે.’ આ પ્રકારની બધી પ્રતિક્રિયા સૂક્ષ્મ અભિમાનની જ કુંપળો, કાંટા અને ઝેરી પાંદડાં જ છે. પરંતુ તે એનેજ પોતાની બુદ્ધિમતા સમજુને સદ્ બુદ્ધિના માર્ગ પર આગળ અનુભવ મેળવવાથી વંચિત રહી જાય છે.

એટલે કહેવાય છે કે નમ્રતા વિના મનુષ્ય શીખી શકતો નથી. જે શીખવા જ નથી દરછતો તે જાણે વૃદ્ધ થઈ ગયો છે. એની ચુવાવસ્થા જ સમાપ્ત થઈ ગઈ છે. જો કોઈ શીખવાનું જ બંધ કરી દે છે તો એનો વિકાસ કઈ રીતે થશે ?

તેથી આધ્યાત્મના પુરુષાર્થીનું સૌથી પહેલાં એ વાત ઉપર દ્વાન હોવું જોઈએ કે હજુ ધારું બધું શીખવાનું છે. જેની પાસેથી જે કંઈક સારી વાત મળે તેને અવશ્ય ધારણ કરવી જોઈએ. આ સમગ્ર જીવન જ અંત સુધી શીખવા માટે છે.

### ગુણ ગ્રાહક વૃત્તિનો અભાવ

શીખવાનો એક રસ્તો એ છે કે ગમે તેના  
(અનુસંધાન પેજ નં. 06 પર)

## તનાવ સ્વાભાવિક નથી

**બ્ર.કુ. શિવાનીબેન, ગુરુગ્રામ, હરિયાણા**



**પ્રશ્ન :** તમે એ બે વર્ષમાં અટલા હતાશ થઈ ચૂક્યા છોવ છો કે તમારી અંદર કાંઈ વધ્યતું જ નથી.

**ઉત્તર :** ભણવાથી હતાશ થતા નથી. મહેનત કરવાથી હતાશ થતા નથી. હતાશા

દબાણનો સામનો કરવાથી આવે છે. રોજ મહેનત કરવી છે, રોજ ભણવું છે એ ચિંતા કર્યા વગર કે શું થશે? શું નહીં થાય એનું તો થઈ ગયું મારું શું થશે? એમાં તુલના (કંપેરીઝન) કરવાની ભાવના, પ્રતિયોગિતાની ભાવના જાગૃત થાય છે. જે આપણા ભાવનાત્મક સ્વાર્થ્ય માટે યોગ્ય નથી. એટલા માટે જો તમે એ વિચારને કાઢી શકો છો તો મનમાંથી કાઢી નાખો. આ કાર્યમાં મેડીટેશન ખૂબ જ મદદ કરે છે. વિદ્યાર્થી જીવનમાં જો એક વિદ્યાર્થી પોતાના દિવસની શરૂઆત સકારાત્મક સંકલ્પોની સાથે કરશે તો કોઈ પણ પ્રકારના નુકસાન વગર ખૂબ જ મહેનત કરી શકશે અને સફળ થઈ શકશે. આપણે જેટલી મહેનત કરીએ છીએ, એનાથી કેટલા ગણી વધારે કરી શકીશું પરંતુ એના માટે આપણે દ્યાન રાખવું પડશે કે આપણું લીકેજ વ્યર્થ કર્યાંયથી પણ ન હોવું જોઈએ. કારણ કે મનમાં ઉર્જા તો એટલી જ છે. એ ઉર્જને તમે કયા ઉદ્દેશ્ય માટે કેન્દ્રિત કરો છો એ તમારા પર નિર્ભર છે.

**પ્રશ્ન :** પરંતુ અત્યાર સુધી જે વિચારને પકડીને ચાલી રહ્યા હતા એનાથી તો તમારું ખૂબ જ નુકસાન થઈ શકે છે.

**ઉત્તર :** બાળકોને જે પરિણામની આશા હોય છે જે એ નથી મળતું તો એનો એ મતલબ નથી કે એ બાળક અસફળ છે.

દિલ્હીમાં ગયા વર્ષની વાત છે. એક છોકરીએ પરીક્ષા દ્વિતીય શ્રેણી (સેકન્ડ ક્લાસમાં) પાસ કરી પણ તેની દરછા અને ઉભ્યે હતી કે એ પ્રથમ શ્રેણીમાં (ફર્સ્ટ ક્લાસ) પાસ થશે. અને એણે એનાથી દુઃખી થઈને આત્મહત્વા કરી લીધી. એ સમયે એની માનસિક સ્થિતિની આપણે કલ્પના કરી શકીએ છીએ કે એ પ્રથમ આવવાના વિચારથી એટલી વધારે જોડાઈ ગઈ હતી કે જ્યારે એ દ્વિતીય શ્રેણીથી પાસ થઈ તો એ સ્વીકાર કરવાની એનામાં ક્ષમતા જ ન હતી.

બાળકો અને પિતા બન્ધે બહુ જ મહિંદ્રપૂર્ણ ભૂમિકા અદા કરે છે. જો તમે મહેનત કરો છો તો પરિણામ સારું આવવાનું જ છે, પરંતુ એ ભયવાળો વિચાર અત્યારથી કરીને, તમારી અંદર પેદા કરીને સ્વયંને હતાશ નહીં કરો. કારણ કે, શું થાય છે. જ્યારે પાલક (વાલી) બાળકોની સાથે સાથે સખત મહેનત કરે છે તો બાળક પણ જુઓ છે કે મોટું પરિણામ પાલક માટેય પણ ખૂબ મહિંદ્રપૂર્ણ છે. જ્યારે મને દેખાય કે આ મારા આવવાર માર્ક્સ જ મારા પાલક માટે ખૂબ જ મહિંદ્રપૂર્ણ છે. એનાથી જ એ ખુશ થશે તો એનાથી પણ એક દબાવ બાળક ઉપર પેદા થઈ જાય છે કે મારે પિતાની ખુશી માટે સારું પ્રદર્શન કરવું છે.

મારી ખુશી કરતાં વધારે મારા પાલકો (માતા-પિતા)ની ખુશી મારા માર્ક્સથી જોડાયેલી છે. આજે બધા દબાણો છે તે અનાવશ્યક છે.

ભણતર પૂરું કરવાનું દબાણ એટલું વધારે છે એ થોડા સમય માટે જરૂરી પણ લાગે છે કે એનો સામનો તો કરી લઈશું પરંતુ આ અપેક્ષાનો દબાવ કે મારી ખુશી એના પર નિર્ભર છે. તમારું આખું જીવન એના પર નિર્ભર છે. આ જે દબાવ છે આ પછી એ અંશને ખૂબ જ વધારે મોટો કરી દે છે અને બાળકો પાસે એટલી શક્તિ નથી હોતી કે એ જે વધેલા અંશનો સામનો કરી શકે. જેનાથી ફળ સ્વરૂપ બાળક વિદ્યાર્થી જીવનમાં જ, અવસાદ, મધુમેહ (ડાયાબીટીસ) એકધારો તનાવ વગેરે વગેરે રોગોથી ગ્રસ્ત થઈ જાય છે. હવે પ્રશ્ન ઉભો થાય છે કે આજ કેમ આમ થઈ રહ્યું છે? કારણ કે બાળકો ઉપર દબાવ ખૂબ જ વધતો જાય છે અને એની સીમા શું છે એ કોઈ નથી જાણતું. સાચી વિચારવાની કળા શું છે એ આજ કોઈ શિખવી રહ્યું નથી. એ પણ કોઈ શિખવી રહ્યું નથી કે પ્રતિયોગિતા સ્વાસ્થ્ય માટે લાભદાયક નથી. આતો જેમ કંપેરીઝન (તુલના કરવી) થઈ ગયું. આજ બધા જ એજ શિખવી રહ્યા છે કે બીજા સાથે તુલના કરવાની છે, પ્રતિયોગિતા કરવાની છે.

**પ્રશ્ન :** જ્યારે એના પિતાએ કહ્યું કે જો હું તનાવ પેદા નહીં કરું તો એ સારું પ્રદર્શન નહીં કરી શકે. આ ખૂબ જ તિંડો વિશ્વાસ છે કે જ્યાં સુધી તનાવ નહીં હોય તો લોકો સારું પ્રદર્શન નહીં કરે. આપણે કાર્યાલયમાં કે બહુરાષ્ટ્રીય કર્મનીયોમાં જોઈએ છીએ કે બોસ બોલે છે કે જો હું આમને લક્ષ્ય નહીં આપું, દબાણ નહીં નાખું, તનાવ પેદા નહીં કરું, તો સારું પ્રદર્શન નહીં થાય.

**ઉત્તર :** આપણે એક વિચારવાની વાત છે કે તનાવ નો મતલબ ડર હોય છે. આપણે પ્રોત્સાહિત કરવા માટે એના મનમાં ડર બેસાડીએ છીએ. જેમ માની લો ડર પ્રેરણા દેવાવાળો થઈ જાય છે. ડર એક નકારાત્મક ઉર્જા છે. જ્યારે પ્રેરણા એક સકારાત્મક ઉર્જા છે. તો એક નકારાત્મક ઉર્જાથી

તમે સકારાત્મક ઉર્જા કેવી રીતે ઉત્પદ્ધ કરી શકો?

તમે એને પ્રેમ આપો, કરુણા આપો, સહયોગ આપો પરંતુ આપણે એને શું આપીએ છીએ ? ભય, જેથી એ પ્રોત્સાહિત થઈ જાય, અત્યારે પણ આપણે કાર્યાલયમાં જોઈએ કે બધા જ લોકો ખૂબ સરસ કામ કરી રહ્યા છે પરંતુ જેવો કોઈ સીનિયર આવીને ઉભો રહે છે જે હુંમેશા ગુસ્સામાં રહે છે. તો તમે જોશો કે બધાની જ નજર સ્વતઃ જ એના તરફ હશે. એ કહેશો, ભૂલો તો કાઢવી જ જોઈએ. એની આલોચના કરતા રહીશું ત્યારે તે સ્વયંને વધારે સુધારી શકશે. જો આપણે આખો દિવસ એની પ્રશંસા કરતા રહ્યા તો એનું પ્રદર્શન સારું નહીં હોય અને એ સારું પરિણામ નહીં આપી શકે.

**પ્રશ્ન :** જો આપણે એની પ્રશંસા કરી તો એ આગામ ભણવાનું બંધ કરી દેશે.

**ઉત્તર :** એ આપણે સમજવાનું છે કે આ બધો ખેલ ઉર્જાનો છે. પ્રોત્સાહન સકારાત્મક ઉર્જા છે, સકારાત્મક ઉર્જા કચારેય કોઈને નુકસાન નથી પહોંચાડી શકતી. સકારાત્મક ઉર્જા હુંમેશા લોકોને સશક્ત કરે છે અને જો આપણે વાત વાતમાં આલોચનાત્મક થઈ જઈશું અને તે પણ એ ઉદ્દેશ્યથી કે આલોચના કરીશું તો જ એ વધારે મહેનત કરશે. કારણકે આપણે આપણા બોસની યા આપણા પાલકોની અપેક્ષાઓ પૂરી કરવા ઈચ્છાએ છીએ. ઇતાં એ આપણા કામમાં ભૂલો શોધશે તો આપણે પ્રેરીત થઈ જઈશું. આ મારી માન્યતા છે પરંતુ આ વિશ્વાસ ખૂબ જ ખોટો છે કારણ કે એનો આધાર જ ખોટી ધારણાઓ ઉપર રાખવામાં આવ્યો છે.

જ્યાં કોઈ મહેનત કરી રહ્યું છે. ત્યાં જઈને તમે આલોચનાત્મક થઈ જશો તો તમે તરત જ એની ઉર્જાને નાટ કરી દો છો યા તો સામેવાળાની

અંદર એટલી તાકાત હોવી જોઈએ કે એ પોતાની આલોચનાના પ્રભાવમાં ન આવે. પરંતુ આજ આપણે બહુ જ જલ્દી એક બીજાની ઉર્જાના પ્રભાવમાં આવી જઈએ છીએ. કોઈ વખત સારું કરતા કરતા એ ઉર્જાના પ્રભાવમાં આવીને ખોટું કરી નાખીએ છીએ.

**પ્રશ્ન :** આપણે દીર્ઘીએ પણ છીએ કે એ આપણી આલોચનાથી પ્રભાવિત થાય.

**ઉત્તર :** હા, આપણે એ દીર્ઘીએ કે એ આપણી આલોચનાથી વધારે સારું કાર્ય કરે. પરંતુ એનાથી આપણને ખુશી નથી મળતી, આલોચના હુંમેશા લોકોને હંતોત્સાહિત કરે છે. તમારે તમારો વિચાર દેવાનો છે, બરાબર છે, એમ નહીં કે કામ બરાબર નથી છતાં પણ તમે કહેશો તમારું કામ બહુ જ સારું છે. એક છે કામ ઉપર આપણો વિચાર દર્શાવવો અને એક છે આલોચના કરવી બંનેમાં ખૂબ જ ફક્ત છે. એટલા માટે શબ્દ એટલો મહિંતવપૂર્ણ નથી હોતો જેટલો એના પાછળનો ઉદ્દેશ, તમે તમારો વિચાર આપતા પણ બીજાને સશક્ત કરી શકો છો અને કોઈ વખત બોલવા છતાં પણ ‘હા ખૂબ સરસ’ પરંતુ તમે એમને નિરૂત્સાહિત પણ કરી શકો છો.

આપણે ફક્ત એ દ્વાન રાખવું જોઈએ કે આપણું દ્વાન ફક્ત કાર્ય પર હોવું જોઈએ. આપણે એ યાદ રાખવું પડશે કે કામ કરવાવાળું કોણ છે? જે કામ કરવાવાળો છે એ શક્તિ છે. એક ઉર્જા છે. અને જ્યાં સુધી સશક્ત નહીં બનીએ તો કામ એટલું વધારે સારું નહીં થાય. આપણી ભૂમિકા એક બોસના રૂપમાં અને એક પિતાના રૂપમાં પ્રોત્સાહન દેવાની હોવી જોઈએ, ન કે આલોચના કરવાની. કામ એ લોકો કરશે, કામ તો એમની જાતે થઈ જશે. જ્યારે એક વરિષ્ઠ સામે આવીને ઉભા રહી જાય છે જે થોડી આ રીતની ઉર્જા મોકલે છે. જેના ફળ સ્વરૂપ હું સારી રીતે કામ નથી કરી શકતો. પછી એ ઉર્જાના પ્રભાવમાં આવવાથી ભૂલો

થવા લાગે છે. અને પછી તે ભૂલો શોધી લે છે કારણ કે એના અંદરની ભાવના હવે બદલાઈ ગઈ છે. હવે એ ભૂલ એટલા માટે થઈ રહી છે કે મારી અંદર હવે ભય પેદા થવાનો શરૂ થઈ ગયો છે કારણ કે આપણો પહેલાંનો અનુભવ પણ એ જ છે કે હવે એ આવી ગયા છે અને એનું આવવું એજ એનું આ રીતે ઉભુ રહેવું જ પૂરા વાતાવરણને બદલી નાખે છે. મતલબ તમે જોશો કે જે કર્મચારી અત્યાર સુધી સારી રીતે કામ કરી રહ્યા હતા, અચાનક જ એનાથી ભૂલો થવાની શરૂ થઈ જાય છે. કારણ કે તનાવ આપણા પ્રદર્શનને વધારતો નથી પણ એ આપણા પ્રદર્શનને વધારે ઓછું કરી નાંખે છે.

**પ્રશ્ન :** ધણા લોકો વિચારે છે કે જેવો હું એની પ્રશંસા કરું છું તો એ માથે ચાડી જાય છે. હું જાણું છું કે આ ખોટું છે પરંતુ એ વાત કહીએ છીએ એ વાત ઘરે પણ હોય કે બહાર હોય. જો એને થોડી છૂટ આપીએ તો મારા માથે ચઢી બેઠા ?

**ઉત્તર :** ચાલો, એના વિશે વાત નથી કરતા. આપણા વિશે વિચારીએ કારણ કે જો હું વરિષ્ઠ છું. તો મારાથી ઉપર કોઈ બીજા વરિષ્ઠ હશે. ન પણ હોય તો હું માની લઉં છું કદાચ મારે કોઈ વરિષ્ઠ હોય તો મને શું સારું લાગશે કે એ મારાથી કેવી રીતે કામ કરાવે, એ મારાથી કેવી રીતે વાત કરે? જ્યારે હું બાળક હતો તો હું શું દીર્ઘતો હતો કે મારા પાલક મારી સાથે કેવી રીતે વાત કરે. શું મારા પાલક મારી સાથે પ્રેમથી વાત કરશે તો હું એનો ખોટો ફાયદો ઉઠાવું, ક્યારૈય નહીં.

**પ્રશ્ન :** ભલે હું તો સારો હતો.

**ઉત્તર :** બધા જ સારા હોય છે, આપણે આ રીતે વિચારીએ છીએ કે આપણે આમ કરીએ પરંતુ વાસ્તવમાં બધા જ આવા છે. દરેક પ્રેમ દીર્ઘે છે. હર કોઈ સહયોગ ચાહે છે. હર કોઈ કરુણા ચાહે

છે. કોઈ મળ્યું તમને જે કહે મારી આલોચના કરો તો વધારે સારું કામ કરીશ. પરંતુ ઘણી વાર એવું થાય છે કે સામેવાળાને આદિત પડી છે. ઠપકો ખાવાની (ગુરુસો સાંભળવાની) તો ઠપકો પડશે જ. આપણે બંનેના સંસ્કાર થોડા એવા થયા છે પરંતુ તમે એક વખત પ્રયાસ કરીને જુઓ કે ગુરુસાથી નહીં પ્રેમથી જ કામ કરાવવું છે. ભલે એ થોડું મોડું કામ કરે. બની શકે એક દિવસ, બે દિવસ, એક મહિનો, બે મહિના લાગી જાય. કામ કરાવવાવાળાનું પરિવર્તન આવવામાં. પરંતુ પરિવર્તન જરૂર આવશે. અને હવે જે કામ થશે એ લોકો બહુ જ પ્રેમથી કરશે અને એકબીજાની નજુક આવી જશે કારણ કે વચ્ચે સકારાત્મક ઉર્જનો પ્રવાહ થઈ રહ્યો છે. તમે કોઈની આલોચના કરો, પછી એ તમારાથી નફરત કરે તો એ રીતે બોસ અને જુનિયરની વચ્ચે સકારાત્મક ઉર્જ પ્રવાહિત નહીં થાય. પરંતુ જ્યાં પ્રેમ, સહયોગ અને સ્વીકૃતિની ઉર્જ પ્રવાહિત હોય છે તો હર કોઈ પસંદ કરે છે અને પછી આપણાને કોઈ કહેશે નહીં કે તમે કામ કરો. આપણું મન ખુદ જ કામ કરતું થશે. એના માટે એની કંપની માટે, કારણ કે એની કંપની હવે, આપણાને પોતાની લાગે છે.

આજ વ્યાપાર જગતમાં કહે છે કે તમે તમારા કાર્યને સ્વયં અધ્યરું બનાવો છો, તમે તમારી બુદ્ધિનો લઈને આવી ગયા. ઓફિસમાં પરંતુ આપણું દિલ ધેર છોડતા આવ્યા. તો શું તમે કામને રૂચિથી કરશો? પછી તમને કામ કરવાનું કહેવું નહીં પડે, કામ થતું રહેશે, એટલી પારદર્શિતા આવી જશે. એક બીજાથી કયારોક કોઈ ભૂલ નહીં થાય અને થશે તો એ ખુદ આવીને સાચું બતાવશે કારણ કે એને ખબર છે કે તમે ગુરુસો કરવાના નથી (ખીજવાના નથી) એટલે એક બીજા વચ્ચે વિશ્વાસની ભાવના પેદા થશે.

**પ્રશ્ન :** એનાથી ભૂલો પણ ઓછી થશે. કારણ કે ડર

નહીં હોય.

**ઉત્તર :** ડરના કારણે એક વિશેષ ચક્ક બને છે, ભૂલ થઈ જાય છે. પછી ડરને કારણે ભૂલને છુપાવે છે. પછી છુપાવીને એનો દોષ બીજા કોઈ ઉપર નાખે છે. જો બોસે મને પકડી લીધો કે મારાથી ભૂલ થઈ છે તો હું તરત બોલીશ કે આ મારા લીધે નહીં એમના લીધે થઈ છે. હવે જેવા આપણે બીજાને દોષી બનાવ્યા તો આપણો અને એનો સંબંધ તો બગડી ગયો અને સારી ઉર્જ નકારાત્મક થઈ ગઈ અને જો પારદર્શિતા છે તો હું વિશ્વાસની સાથે કહી શકીશ કે મારાથી ભૂલ થઈ ગઈ અને એ એજ સમયે સમાપ્ત થઈ જશે.


ક્યાંચ પણ મારો ઉદ્દેશ્ય એ ન હતો. તો એ આત્મવિશ્વાસ રહેશે કે છા ઠીક છે. આજ બાળકોથી વાત શરૂ કરીએ તનાવને આપણે જોયું કે જ્યારે જેટલી મારી આંતરિક સ્થિરતા, આંતરિક પ્રતિરોધક ક્ષમતા વધતી જતી હતી, એ જે તનાવ હતો એ વધારે ઓછો થતો હતો. આપણે કહ્યું કે જેટલો તનાવ હશે એટલું મારું પ્રદર્શન વધશે તો અહીંયાં આ સમજમાં આચ્યું કે તનાવ જે હતો એ મારું પ્રદર્શન ન હતું. એ મને વધારે કમજોર કરી રહ્યું હતું એના મારે તનાવને નજર અંદાજ કરવો જોઈએ.

॥ ઓમશાંતિ ॥

- અવગુણ તો નાવડામાં પડેલાં કાણાં જેવા છે. નાવડામાં પડેલું કાણું ભલે નાનું હોય કે મોટું, પણ એ નાવડાને ઢૂબાડે છે. અવગુણાનું પણ એવું છે. જીવનરૂપી નાવમાં અવગુણરૂપી એક પણ કાણું પડી ચૂકચું તો સારાય જીવનનો કબજો લઈ જીવનને છિન્ન છિન્ન કરી નાખે છે. આવા અવગુણરૂપી કાણાંથી આપણા જીવનને બચાવવું જ રહ્યું.

# વિદ્યાનું કારણ - સૂક્ષ્મ અપવિત્રતા

બ્ર.કુ. સૂર્ય, જ્ઞાન સરોવર, માર્ગિલ આબુ



**પ્રશ્ન** - જીવનમાં નાના મોટા વિદ્યા આવતાં જ રહે છે. તેનું કારણ સમજાતું નથી. તેથી તેનું કારણ જાણીને એનું નિવારણ કરવા દર્શીએ છીએ.

**ઉત્તર** - જીવનમાં અનેક વિદ્યાનું કારણ શું છે? કેટલીક વાર સખત મહેનત પછી જ સફળતા મળે છે. ક્યારોક તે પણ નથી મળતી. એનું મૂળ કારણ છે સૂક્ષ્મ અપવિત્રતા.

આમ તો વિદ્યાનાં ઘણાં કારણો છે. જેમાં પૂર્વજ્ઞોના પાપ કર્મ, મનુષ્યનો સીમિત દૃષ્ટિકોણ, વ્યવહારિક અકુશળતા અને નબળું મન મુખ્ય છે. નબળું મન વિદ્યાને રોકવા માટે અસમર્થ બને છે. તથા સૂક્ષ્મ અપવિત્રતા જાણે કે વિદ્યાનું આવાહન કરે છે.

**સૂક્ષ્મ પવિત્રતા શું છે?** દૈહિક આકર્ષણ, દર્શકરીય મર્યાદાઓનું ઉલંઘન, અપવિત્ર સંકલ્પ અને કામુક દર્શાવો. આ સર્વ વિકૃતિઓ સ્થિતિને પણ નબળી બનાવે છે તથા બુદ્ધિની નિર્ણયશક્તિને પણ સમાપ્ત કરે છે.

તેથી આ રીતે જો જીવન સૂક્ષ્મ અપવિત્રતાથી ભરેલું છે. તો અમૃતવેળાના યોગમાં આનંદ આવશે નહીં અને દર્શકરીય મહાવાક્યો મનને પરમસુખ આપશે નહીં. તેથી બુદ્ધ એકાગ્ર થશે નહીં અને ચિત્ત શીતળ બનશે નહીં.

આવો આત્મા સેવાના ક્ષેત્રમાં પણ મહેનત વધારે અને સફળતા ઓછીનો અનુભવ કરશે.

એમની સામે સદા સંદર્ભની સ્થિતિ જણાશે. સંબંધોમાં તાણ રહેશે અને મુખ્યત્વે સેવા સ્વરૂપ બનેલું જીવન સાધનોની માંગણી કર્યા કરશે અને સાધનાથી યોજનો દૂર ચાલી જશે.

લોકિક ધંધાઓમાં વિદ્યન આવે, યા લોકિક પરિવારમાં અણાદારી ઘટનાઓ બનતી રહે છે. યા કંઈક ગ્રહચારી હોવાનો અનુભવ થશે. એક પછી એક દુર્ઘટના થતી રહે છે યા લોકિક નોકરીમાં વિદ્યન આવી રહ્યા હોય તેમ લાગે છે. જીવનમાં ખુશી મળતી નથી યા બુદ્ધ ભારે ભારે લાગે છે. પુરુષાર્થીએ પોતાની પવિત્રતાની સ્થિતિને ચેક કરીને નબળાઈને સુધારી લેવી જોઈએ. સ્થિતિ શ્રેષ્ઠ બનતાં જ વિદ્યન સમાપ્ત થઈ જાય છે. રસ્તો સાફ થઈ જશે. એવું લાગશે કે મન ઉપરથી ભારે બોજ ઊતરી ગયો હોય. મન એક અલોકિક ખુશી યા હળવાપણાનો અનુભવ કરશે. પવિત્રતાના રાહીએ સર્વ મર્યાદાઓનું પાલન સહર્ષ કરતું જોઈએ. મર્યાદા તોડતાં જ મન નબળું બની જાય છે. વિદ્યાનો પ્રારંભ થઈ જાય છે.

પવિત્રતાની શક્તિ ઘણી મોટી શક્તિ છે. આપણાને આ શક્તિનો સંપૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ. નજીકના ભવિષ્યમાં જ્યારે અનેક બીમાર વ્યક્તિનોની લાઇન આપણી સામે ઊભી રહેશે. જ્યારે વિદ્યાની વ્યાકુળ આત્માઓ આપણા દરવાજા ખખડાવશે, ત્યારે પવિત્રતાના બળથી સંપન્ન આત્માઓ જ પોતાની દૃષ્ટિ વ્યાધિ મુક્ત તથા વિદ્યામુક્ત કરી શકશે.

પવિત્રતા જ જીવનમાં દિવ્યતા લાવે છે. અપવિત્રતા શોભાને બગાડી દે છે. જ્યાં પવિત્રતાનું

બળ છે ત્યાં વિજય નક્કી છે. આ પ્રમાણેનો જુવનમાં સંપૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ. તો પવિત્રતાનું બળ આપણને કલિયુગી સાગરમાં, વિદ્યાની ભયંકર લહેરોમાં પણ આનંદથી તરવાનું બળ આપે છે. અર્થાત્ જુવનને નિર્વિદ્ધ તથા તાણમુક્ત બનાવે છે.

**પ્રેષણ -** કુંડલિની શું છે? કુંડલિની જાગૃત કરવી શું છે? રાજ્યોગમાં તેનું શું સ્થાન છે? શું આપણી કુંડલિની જાગી છે?

**ઉત્તર -** કુંડલિનીને સાધકોએ શિવની શક્તિરૂપે સ્વીકારી છે. એનું રૂપ અતિસૂક્ષ્મ છે. અહીં તેનું સંક્ષિપ્ત વર્ણન કરીશું. તે આ શરીરમાં આવેલી એક શક્તિ છે.

આધુનિક ચિકિત્સા વિજ્ઞાને શરીરમાં આઠ ગ્રંથીઓનું અસ્તિત્વ નિછાળ્યું છે. આજે શોધખોળો પ્રત્યક્ષ દર્શન યા પ્રયોગશાળાઓના આધારે થાય છે. પ્રાચીનકાળમાં શોધો અંતર્દ્દિષ્ટ દ્વારા દર્શનના આધારે થતી હતી. આજ ગ્રંથીઓ જ વિભિન્ન ચક્ર છે. આ ગ્રંથીઓ જ સમગ્ર શરીરના વિકાસ તથા નિયંત્રણનો આધાર છે.

મસ્તકમાં સહસ્રારયક / જ્ઞાનકેન્દ્ર અથવા પીનિયલ ગ્લેન આવેલ છે. મેરું દંડ અથવા કરોડરજ્જુ નીચે શક્તિ કેન્દ્ર મૂલાધાર ચક્ર અર્થાત ગોનાલ ગ્લેન આવેલ છે. આ મૂલાધાર ચક્રમાં એક અંદોળા આકારનો પ્રશ્ન છે. એમાં કુંડલીના આકારની સાડાઅણ ચક્રમાં બેઠેલી સૂક્ષ્મ કુંડલિની શક્તિ છે. આ શક્તિનું વર્ણન વર્તમાન શરીર દરચનાના જ્ઞાતાઓનો નથી કરતા, પરંતુ પ્રાચીન મનીખીઓએ અંતર્દ્દિષ્ટથી તેનું દર્શન કર્યું છે.

મેરુદંડની અંદર ઈંડા તથા પિંગલા નામની બે નાડીઓ છે. જેમાંથી એક મસ્તિષ્કમાં સંદેશ લઈ જાય છે. તથા બીજી મસ્તિષ્કના આદેશ બહાર

લાવે છે. આ બંનેની વચ્ચે એક સૂક્ષ્મ નાડી સુષુપ્તા છે. આ સુષુપ્તા નાડી (સ્નાયુ) નીચેથી બંધ છે. અને નીચેથી કુંડલિની શક્તિ સાથે જોડાયેલી છે. જે સૂક્ષ્મ અવસ્થામાં છે.

યોગી એવું માનતા હતા કે જે આ કુંડલિની શક્તિને જાગૃત કરવામાં આવે તો આ શક્તિ સુષુપ્તા નાડીથી થઈને ઉપર ચાલવા લાગે છે અને વિભિન્ન ચક્રોમાં થઈને મસ્તકમાં આવેલ જ્ઞાનકેન્દ્રમાં પહોંચી જાય છે. આ શક્તિ જે જે ગ્રંથીમાંથી પસાર થાય છે ત્યાં વિશેષ પ્રતિક્રિયા થાય છે. જ્યારે આ શક્તિ જ્ઞાનકેન્દ્રમાં પહોંચી જાય છે તો યોગીઓને આત્મસાક્ષાત્કાર થાય છે. એના જુવનમાં દિવ્યતા આવે છે. અર્થાત્ એનાં બદાં બંધન કપાઈ જાય છે.

આ શક્તિને જગાડવાનું સાધન પ્રભુપ્રેમ, ગુરુકૃપા યા કોઈપણ સાધના છે. કોઈની આ કુંડલિની શક્તિ થોડી લાગે છે. તો કોઈકની વધારે લાગે છે. જે કોઈ મનુષ્યમાં થોડો પણ જ્ઞાન પ્રકાશ દેખાય તો સમજવું જોઈએ કે એની કુંડલિની શક્તિ સુષુપ્તામાં પ્રવેશ કરી ગઈ છે.

ઉપર મેં સંક્ષેપમાં કુંડલિની શક્તિનું વર્ણન કર્યું છે. હવે આપણે આપણા વિચાર તથા રાજ્યોગના સંબંધનો વિષય લઈએ. મને સ્વયં ઈશ્વર દ્વારા ઈશ્વરીય જ્ઞાન મળ્યું. પ્રથમ ચરણમાં જ મને આત્મજ્ઞાન તથા આત્મ સાક્ષાત્કાર થઈ ગયો. જેમ જેમ આપણે રાજ્યોગ સાધનાના પથ ઉપર આગળ વધીએ છીએ તેમ તેમ આપણને આપણા આદિ તથા અનાદિ સ્વરૂપનો સ્પષ્ટ સાક્ષાત્કાર થાય છે. મનમાં અપાર ખુશીઓની શરણાર્થા વાગે છે. અતીન્દ્રિય સુખ આપણું જુવન બની ગયું છે. અર્થાત્ આપણી કુંડલિની સંપૂર્ણરૂપથી જગી ચૂકી છે.

ભારતીય યોગ દર્શનમાં યોગસાધનાનો પ્રભાવ શરીર પર જ્ઞાનવવામાં આવ્યો છે. પ્રાણાયામથી શરીરમાં થનારું પરિવર્તન હ્યાનનો સ્નાયુઓ ઉપર પ્રભાવ, મનબુદ્ધિને પ્રકૃતિકૃત માનવાને કારણે યોગ શરીર સાથે જોડવામાં આવ્યો. એ તો સત્ય છે કે શરીરની સમસ્ત ક્રિયાઓનું સંચાલન મનની શક્તિથી જ થાય છે. પરંતુ મન શરીરનું જ અંગ છે. એ માનવું તો ભૂલ ભરેલું છે.

અમને પરમપિતા પરમાત્મા દ્વારા પ્રાપ્ત ઈશ્વરીય જ્ઞાનથી એ જાળવાનું મળ્યું છે કે મન, બુદ્ધિ, આત્મિક શક્તિઓ છે. બીજે કંઈ હ્યાન ન લગાવતાં રાજ્યોગમાં આપણે અશરીરી બનવાનો અભ્યાસ કરીએ છીએ. અર્થાત् આપણે જ્ઞાનકેન્દ્રની સમીપ આવેલ આત્મા પર એકાગ્ર થઈએ છીએ. એનો પ્રભાવ આપણી સમગ્ર સ્નાયુ ક્રિયા પર પડે છે. તેનાથી શરીરમાં વિભિન્ન પરિવર્તન થાય છે.

જો શરીરમાં કુંડલિની શક્તિ છે તો તે અવશ્ય રાજ્યોગથી જગૃત થાય છે, તે સત્ય છે. પરંતુ એનું વિશ્લેષણ બીજી રીતે પણ કરીશું. આ એક ચિંતન વાયકો સમક્ષ રજૂ કર્યું છે. મૂલાધાર ચક્રમાં શક્તિનો સંગ્રહ થાય છે અર્થાત् શુક્ષશક્તિ એકપ્રિત થાય છે. જે નિરંતર અન્નથી બનતી રહે છે. યોગ અભ્યાસમાં આપણે અશરીરી બનીને પોતાની બુદ્ધિ પરમધામમાં સ્થિત પરમાત્મા સાથે જોડીએ છીએ. તેનાથી આ શુક્ષગતિની સ્થિતિ ઉપરની તરફ જાય છે. આ સુષુપ્તિ નાડીના માદ્યમથી વિવિધ ગ્રંથીઓમાં થઈને પીનિયલ ગ્લેન્ડ - જ્ઞાન કેન્દ્રમાં ચાલી જાય છે. વિભિન્ન ગ્રંથીઓ તેનો થોડો થોડો અંશ ગ્રહણ કરે છે. અંતમાં આ શક્તિનો સૂક્ષ્મ અંશ પીનિયલ ગ્લેન્ડમાં પહોંચે છે કે જે વાસ્તવમાં મર્સિયિક માટે

સૂક્ષ્મ શક્તિ છે. જેના દ્વારા મર્સિયિક નિરંતર કાર્યરત છે. આ કારણે યોગ અભ્યાસ માટે બ્રહ્મચર્યનું પ્રથમ સ્થાન છે. જો કોઈ વ્યક્તિ બ્રહ્મચર્ય પાલન નથી કરતી તો એની શક્તિ નિરંતર નાટ થતી જાય છે. જેથી એનું મર્સિયિક પૂર્વી રીતે શક્તિ મેળવી શકતું નથી. ફલ સ્વર્પે મન ચિંતનમાં સ્થિર થતું નથી તેમજ બુદ્ધિ પરમાત્મામાં સ્થિર થતી નથી.

કદાય આ શક્તિને ઉપર લઈ જવી તેને જ કુંડલિની જગૃત કરવી કહેવાય છે. ગમે તે હોય રાજ્યોગમાં કોઈ શારીરિક ક્રિયાને સ્થાન નથી. હા, રાજ્યોગ દ્વારા આ શક્તિનો અવશ્ય જગૃત થાય છે. જીવન દિવ્યતાથી ઓતપ્રોત બની જાય છે.

**પ્રશ્ન - મનુષ્યનો વિકાસ ક્યારે અટકી જાય છે?**

**ઉત્તર -** જ્યારે એક મનુષ્ય એ સમજે છે કે મે સર્વ કાંઈ જાણી લીધું છે. જ્યારે તે કાંઈ પણ શીખવા માટે પોતાની બુદ્ધિનાં દ્વારા બંધ કરી લે છે અર્થાત् એની શીખવાની વૃત્તિ ઢંકાઈ જાય છે ત્યારે તે ઉપદેશોથી ભયભીત બને છે. ત્યારે તે એને કંઈક શીખવાનારને પોતાનો શાશ્વત માને છે. ત્યારે મનુષ્યની પ્રગતિનો માર્ગ થંભી જાય છે.

કેટલાક પુરુષાર્થી એ સમજુ લે છે કે એમણે સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે. વાસ્તવમાં એક બુદ્ધિમાન મનુષ્યની આ સૌથી મોટી ભૂલ છે. એણે જાળવું જોઈએ કે જ્યારે તેને સંપૂર્ણ જ્ઞાન મળી જશે, ત્યારે એની બુદ્ધિ ભટકતી બંધ થઈ જશે. એની બુદ્ધિ ડીસ્ટર્બ પણ નહીં થાય. તેની ચારે બાજુની મમતા પણ સમાપ્ત થઈ જશે. સ્થિતિ પૂર્ણ રીતે ઉપરામ બની જશે. આ સૂક્ષ્મ અહંકારે કેટલાયે પુરુષાર્થી એ સમજુ લે છે કે એમણે સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે. વાસ્તવમાં એક બુદ્ધિમાન મનુષ્યની આ સૌથી મોટી ભૂલ છે. એણે જાળવું

જોઈએ કે જ્યારે તેને સંપૂર્ણ ઝાન મળી જશે, ત્યારે એની બુદ્ધિ ભટકતી બંધ થઈ જશે. એની બુદ્ધિ ડીસ્ટર્બર્ પણ નહીં થાય. તેની ચારે બાજુની મમતા પણ સમાપ્ત થઈ જશે. સ્થિતિ પૂર્ણ રીતે ઉપરામ બની જશે. આ સૂક્ષ્મ અહંક કારણે કેટલાચે મનુષ્ય દિનપતિદિન ઈશ્વરીય મહિવાક્ય પણ સાંભળતા નથી અને એમને અદ્યયનમાં પણ દુચિ રહેતી નથી.

તે રીતે યોગ પણ એક અત્યંત સૂક્ષ્મ વિષય છે. જ્યાં સુધી આપણે સંપૂર્ણ બનીએ ત્યાં સુધી યોગની સૂક્ષ્મ વિધિઓ તથા એના સૂક્ષ્મ અનુભવોને પ્રાપ્ત કરતાં જ જઈશું. તેથી એવું માની લેવું કે આપણે યોગ પૂર્ણપૂર્ણ શીખી લીધો છે. તો તે બુદ્ધિમાનીની નિશાની નથી. જ્યારે આપણે યોગને સંપૂર્ણ રીતે શીખી લઈશું તો આપણે સંપૂર્ણ બની જઈશું. આપણે આપણા આદિ તથા અનાદિ સ્વરૂપમાં સ્થિત થઈ જઈશું અને આપણે નિરંતર અતીન્દ્રિય સુખમાં રમણ કરીશું.

એટલે જીવનમાં નિરંતર ઉન્નતિના પથ પર અગ્રેસર બનવા માટે સદાચે બીજાઓ પાસે શીખતા રહેવું જોઈએ. જીવનમાં આવનારી પરિસ્થિતિઓમાંથી તથા ભૂતકાળમાં કરેલી પોતાની ભૂલોમાંથી સદા શીખવાની વૃત્તિ અપનાવવી જોઈએ. જે આપણાને કંઈક શીખવાડે છે તેને આપણા સાચા હિતેચ્છુ અને પરમભિત્રો સમજવા જોઈએ. આપણે આપણા શીખવાનાં દ્વાર ખુલાં રાખીએ. આપણાને જો કોઈની શિખામણ સારી લાગતી નથી. તો આપણે ખોટું લગાડવું જોઈએ નહીં. આપણે આપણું જીવન એટલું સરળ બનાવવું જોઈએ જેથી સમય આવે કોઈ આપણાને સહયોગી બને. આપણાને કોઈ લડી પણ શકે. ત્યારે આપણું ક્યારેય અહિત નહીં થાય.

**પ્રશ્ન -** અમે સાંભળ્યું છે કે આપની સંસ્થાના

વિદેશોમાં પણ ઘણાં સેવાકેન્દ્રો છે તો શું ત્યાંના લોકો બ્રહ્મચર્યની ધારણા તથા ખાનપાનની શુદ્ધિ અપનાવે છે. જો એમ હોય, તો તે ખરેખર ઈશ્વરીય શક્તિ છે.

**ઉત્તર -** અમારાં આ સમયે 140 દેશો કરતાંથે વધુ દેશોમાં અનેક સેવાકેન્દ્રો આવેલા છે. જ્યાં આવનાર લોકો હિન્દુ, મુસ્લિમ, શીખ તથા પ્રિસ્ટી વગેરે સર્વધર્મોમાં માનનાર છે. એ હકીકત છે કે ત્યાંનું જીવન ભારતના જીવન કરતાં બિન્ન છે. અહીં હજુ સુધી લોકોને બ્રહ્મચર્ય અને સાત્ત્વિક આહારમાં શ્રદ્ધા છે. પરંતુ વિદેશોમાં તો બ્રહ્મચર્યને મૂર્ખતા સમજવામાં આવી છે. ત્યાં તો સંભોગ જ જીવનનું સુખ છે. આ પ્રમાણે ત્યાં લોકોની ધારણા છે તેથી ત્યાં કામની નદીઓ ખુલી રીતે વહે છે. લગભગ પ્રત્યેક મનુષ્ય માંસાહારી છે. એ ઠંડા પ્રેદેશમાં લોકો ક્યારેક ક્યારેક જ સ્નાન કરે છે.

આમ છતાં તેઓ ઈશ્વરીય ઝાન લઈને રાજ્યોગના પાવન પથ ઉપર પગલાં માંડે છે. તો એમના જીવનનું અદ્ભુત પરિવર્તન, એમના સ્વયંના માટે પણ એક અવિસ્મરણીય ગાથા બની જાય છે. તેઓ શું હતા ને શું બની ગયા. પશુ તુલ્ય હતા. પણ માનવ બની ગયા. એમ કહીને તેઓ પોતાના જીવન પરિવર્તનની પ્રશંસા કરે છે.

બ્રહ્મચર્ય હવે એમનું જીવન બની ગયું છે. હવે તેઓ હોટલો તથા રેસ્ટોરન્ટોમાં જતા નથી. એમનો ફિલ્મો જોવાનો શોખ ઓસરતો જાય છે. અને ત્યાગમય જીવનની ધારામાં નિત્ય સ્નાન કરીને તેઓ શક્તિશાળી બનતા જાય છે. અમારે ત્યાં અહીં માઉન્ટ આબુમાં (મધુવનમાં) દર વર્ષ હજારો વિદેશીઓ આવે છે. એમને જોઈને સૌને બદલી લાગે છે કે બ્રહ્માકુમારીઓએ આ સૌને બદલી દીધા છે. એમનો શ્વેત ભારતીય પોશાક જોઈને

(અનુસંધાન પેજ નં. 26 પર)

# ‘ફોલો ફાધર’નો પુરુષાર્થ

બ્ર.કુ. પ્રો. ચંદ્રવદન ચોકસી, લડિયાદ

ફોલો - Follow માના ‘અનુસરો’ - ‘આજ્ઞા માનો - યા ‘આદેશનું પાલન કરો.’

કોને અનુસરવાનું છે? અનુસરણીય યા અનુકરણીય (ઉદાહરણમૂર્ત) કોણ છે? કોની આજ્ઞા અને આદેશ (હુકમ)નો અમલ (ધારણા) કરવાનો છે? ઉત્તર પણ સ્પષ્ટ છે. ફોલો ફાધર જે ‘બાપ’ યા ‘પિતા’ છે તેની આજ્ઞા યા આદેશનું પાલન કરવાનું છે. જે પ્રમાણે ‘બાપ’ યા ‘પિતા’ એ પુરુષાર્થ કર્યો તેનું અનુસરણ કરવાનું છે.

સંગમયુગમાં શિવપિતા સૃષ્ટિપરિવર્તનના અને યુગ પરિવર્તનના દિવ્ય કર્તવ્ય માટે અવતરણ કરે છે ત્યારે ‘ફાધર’-પિતાનો પરિચય થાય છે. આ જન્મ અને શરીર આપવાને નિમિત્ત બનેલ ‘દેહધારી પિતા’ અર્થાત્ લોકિક પિતા, જે ભૌતિક જરૂરિયાતોની પાલના કરે છે. ભૌતિક વારસો આપે છે. આ ઉપરાંત ‘અલોકિક’ પિતા તરીકે ‘પ્રજાપિતા બ્રહ્મા’ની પણ ઓળખ આપે છે. જે ઈશ્વરીય જન્મની અને જ્ઞાનની પાલના માટે નિમિત્ત બને છે, અને જેમના તન દ્વારા શિવ પરમાત્મા દિવ્ય કર્તવ્ય કરે છે. આત્માઓના પિતા તરીકે પરમાત્મા તરીકે (શિવ)ને આપણે ‘ત્વમેવ માતા શ્વ પિતા’ તરીકે સંબોધન કરતા આવ્યા જ છીએ.

આમ ત્રણ પિતા સાથે જ્ઞાનમાર્ગમાં આપણા સંબંધો છે, ત્યારે ‘ફોલો’ કયા પિતાને કરવાના? દેહધારી પિતા અદ્યાત્મ (જ્ઞાન) માર્ગે લઈ જવાનું કર્તવ્ય બજાવતા નહિ હોવાથી એમની દોરવણી અને આદેશને અનુસરવાની વાત તો છે જ નહિ.

હવે ‘અલોકિક પિતા’ - બ્રહ્મા અને

પારલોકિક પિતા શિવ પરમાત્મા (નિરાકાર-જ્યોતિ સ્વરૂપ) આમ બે પિતામાંથી કોણે ફોલો કરવાના ? એકને? બીજાને? કે બન્નેને? જો એકને, તો બીજાને શા માટે નહિ? અને જો બન્નેને તો કયા કયા સંદર્ભમાં? આ પ્રશ્નોનું મંથન અને ચિંતન ખૂબ જ જરૂરી અને પુરુષાર્થને આગામ વધવા માટે ઉપકારક થઈ પડે તેમ છે. ‘ફોલો-ફાધર’ એ એક આજ્ઞા છે. માર્ગદર્શન છે. એક પથ-પ્રદર્શન છે. ‘ફોલો-ફાધર’ અર્થાત્ ‘બાપ સમાન બનો’. મજાની વાત તો એ છે કે બન્ને બાપ (પ્રજાપિતા બ્રહ્મા અને શિવબાબા) આ વાત અવાર-નવાર મુરલીઓ દ્વારા કરે છે. જ્યારે પરમપિતા શિવ - ‘બાપ સમાન બનો.’ એમ આજ્ઞા કરે છે, ત્યારે પ્રજા પિતા બ્રહ્મા બાબાએ કરેલ પુરુષાર્થને લક્ષમાં રાખીને તે પ્રમાણે પુરુષાર્થ કરો, એમ સૂચયે છે. કારણ બ્રહ્મા મુરળી ગોડલી સ્ટૂડન્ટ છે. સ્ક્રૂલમાં પણ શિક્ષક સૌથી વધ્ય હોંશિયાર વિદ્યાર્થીની જેમ મહેનત કરવા માટે વર્ગના અન્ય વિદ્યાર્થીઓને કહે છે, તેવી જ વાત છે. બ્રહ્માબાબાના પુરુષાર્થને શિવપિતાનું સાંટિફિકેટ પ્રાપ્ત થઈ ગયું છે. તેની પ્રતીતિ શિવબાબાની આ આજ્ઞામાં છે. બ્રહ્માનો પુરુષાર્થ એક ‘સેમ્પલ’ રૂપે આપણી સમક્ષ છે. શિવબાબાની પ્રત્યેક શ્રીમતને સંપૂર્ણપણે, સર્મર્ણાભાવે અનુસરનાર શ્રેષ્ઠ ઉદાહરણ બ્રહ્માબાબા છે. ‘યજ્ઞ’ની સ્થાપનાથી શરીર કરીને તેમની ત્યાગ ભાવના, નભ્રતા, મહાનતા, તપશ્ચર્યા નિમિત્ત પન, ચજાની સંભાળ, બેછદની રહમવૃત્તિ અને સર્વપ્રતિ સમાન સ્વરૂપે સ્નેહભાવ, સાક્ષી અને દૃષ્ટાભાવ અને આ સર્વ પુરુષાર્થની ફલશ્રુતિ સ્વરૂપે બનેલી

તેમની અવ્યક્ત સ્થિતિ - આ બધું બ્રહ્માબાબાના પુરુષાર્થમાં એકી સાથે અને સંપર્ણ સ્વરૂપમાં સૌ કોઈ 'યજ્ઞવત્સ'ને દૃષ્ટિગોચર થતું. એમના પુરુષાર્થની તોલે કોઈ આવી શકે નથી. વળી શિવબાબાની પ્રત્યેક શ્રીમતને તરત જ પ્રેક્ટીકલમાં મૂકવાની 'એક ધખ' એમનામાં જોવા મળતી તેથી પણ શિવબાબાએ આપણાને 'યજ્ઞવત્સો'ને ફોલોફાધરનો આદેશ આપ્યો.

પરંતુ આ જ આજા 'બાપ સમાન બનો - ફોલો ફાધર' - બ્રહ્માબાબા પણ આપે છે. મુરલીઓ દ્વારા બન્ને 'બાપ' અવારનવાર આ આજા આપતા હોય એવું તારવી શકાય છે. જાણો બન્ને 'બાપ' એકબીજાને આગળ રાખી રહ્યાં ન હોય? અથવા તો બન્ને એવા તો એકરૂપ છે કે કચારે કોણ બોલે છે, અને કોણ કર્તવ્ય કરે છે એ અલગ પાડવું પણ મુશ્કેલ થઈ પડે. આમ છતાં બ્રહ્માબાબા ઈશ્વરીય મુરલી સ્ટુડન્ટ અને શિવબાબા બેછણના બાપ-ટીચર અને સતગુરુ છે - એટલે બન્નેની દૃષ્ટિ બોલ, કર્તવ્ય અને વ્યવહાર વચ્ચેનો ફર્ક ધણાં યજ્ઞવત્સોએ પારખ્યો પણ છે. કારણ શિવબાબાનું તો આવવા-જવાનું રહેતું હતું. સદા બ્રહ્માતનમાં રહેતા નહોતા. એટલે આ ફર્ક પારખી શકાયો છે. જ્યારે કેટલાંક યજ્ઞવત્સો આ ભેદમાં 'અભેદ' જુઓ છે. કારણ, બ્રહ્માના હરકર્મની પણ જવાબદારી શિવબાબાએ સ્વીકારી હતી બન્ને વચ્ચેનું યુગ્મ ચા જુગાલ જોડી કેવી અદ્ભુત! માટે જ તો 'ત્વમેવ માતા શ્વ પિતા' નું સંબોધન થતું આવ્યું છે. જેનું રહસ્ય પણ સૂક્ષ્મ અને ગુપ્ત છે.

એક અવ્યક્ત વાણીમાં શિવબાબા કહે છે... 'જિસ પુરુષાર્થ દ્વારા બાપ કે ગુણો ઔર કર્તવ્યોંકી રૂપરેખા દિખાઈ દે, ઈસકો કહા જતા હૈ 'ફોલોફાધર'.

બાપના ગુણો કયા? (કર્તવ્ય - 'વિશ્વ-

પરિવર્તન' તો શિવપિતા વત્સોના સહયોગથી કરી જ રહ્યા છે.) ગુણોનું પ્રદર્શન યા અભિવ્યક્તિની પ્રતીતિ પણ સાકારતન દ્વારા જ થઈ છે. બ્રહ્મા પણ ધીમે ધીમે 'ગુણમૂર્ત' પુરુષાર્થથી બન્યા. બાકી આત્મા તો તમોપ્રદાન હતો. તો ફોલો કરવા એમ સ્પષ્ટ નથી થતું? વળી, બ્રહ્મા તો સર્વ ગુણસંપણ્ણ બનીને સંપૂર્ણ અવર્થા અથર્ત અવ્યક્ત અવર્થાએ પહોંચ્યા. એટલે 'ગુણમૂર્ત' બની ગયા. માટે 'બ્રહ્માને ફોલો કરો' એમ શિવબાબા નથી કહેતા? બન્ને વાત બરાબર હવે જુઓ ફરી કહે છે. 'કેસે બાપ કે ઈશ્વરીય સંસ્કાર, દિવ્ય સ્વભાવ, દિવ્ય વૃત્તિ વ દિવ્ય દૃષ્ટિ સદા હૈ, કયા વૈસે હી વૃત્તિ, દૃષ્ટિ સ્વભાવ વ સંસ્કાર બને હોય?' કોણ પૂછે છે? કોને પૂછે છે? આત્માઓને, આત્માઓના પિતા પરમાત્મા આ વાત પૂછે છે. તો આ અવર્થાનું ઉદાહરણ તો બ્રહ્મા છે. અને તેનો જ નિર્દેશ કરીને શિવબાબા 'બ્રહ્માબાબાને ફોલો કરો' - જુઓ એમના જેવો દિવ્ય સ્વભાવ સંસ્કાર દિવ્ય દૃષ્ટિ-વૃત્તિ તમારામાં આવી છે? એમ પૂછે છે શું ફોલો કરવાનું છે, એ બતાવીને પછી આવો પુરુષાર્થી સેમ્પલ તમારી સમક્ષ છે એમ પણ સૂચયે છે. કારણ 'બને હૈ?' એ પ્રશ્નમાં 'બ્રહ્મા તો હૈનું, ઔર આપકો અભી બનના બાકી હૈનું.' એવો મીઠો ઠપકો પણ છે.

'સિફ્ફ ઈશ્વરીય સેવાધારી નહીં લેક્નિન હરકર્મ પર, હર સંકલ્પ મેં ફોલો ફાધર' પુરુષાર્થની આ સીડી પર બ્રહ્માની જેમ તમે સૌ યજ્ઞવત્સો પણ ચાઢો. બ્રહ્મા એ કોને ફોલો કર્યા? એમની સામે તો કોઈ જ ઉદાહરણ ન હતું? માત્ર સાક્ષાત્કારના પ્રણ પ્રસંગો ને કાંઈ દિવ્ય પ્રેરણાઓ તથા પોતાના તન દ્વારા અન્યને થતા સાક્ષાત્કારો આ સિવાય કોઈ મૂર્તિ, કોઈ ઉદાહરણ, કોઈ સેમ્પલ એમની સમક્ષ ન હતો. તો પણ કેવો ભવ્ય અને મહાન ત્વાગ! વળી કહે 'મુઝે ભી માયા સે

લડના પડતા હૈ. મૈં ભી શિવબાબાકો ભૂલ જાતા હું.. મુજે ચાદ દિલાના.' સર્વાઈ, સફાઈ અને નમ્રતાના આવા તો અનેક પ્રસંગો હશે.

શિવબાબા પૂછે છે, 'એસે ઈશ્વરીય સીરત વાળી સૂરત બની હૈ?' તો નિર્દેશ કઈ સૂરત માટે છે?

મને લાગે છે, ફોલો ફાધરની આજ્ઞા પણ શિવબાબાએ બ્રહ્માના પુરુષાર્થની ઊચી ક્ષિતિજે જોયા પછી જ આપી હશે. ચિહ્નાની શરૂ શરૂમાં આ આજ્ઞા આપી હોય એવી સંભાવના કદાચ નહિ હોય.

માસ્ટર સાહેબ કલાસમાંથી બહાર કયાંક ગયા હોય, ત્યારે વડો નિશાળિયો તેમનું કામ સંભાળી લેતો હોય છે. એવી જ કોઈક વ્યવસ્થા બ્રહ્માબાબા અને શિવબાબા વચ્ચે હોવાની વાત બ્રહ્મ. રમેશભાઈએ (મુંબઈ) એક વાર લખી હતી. આ વડો નિશાળિયો (બ્રહ્મા) ધીરે ધીરે શિવબાબા સમાન બનીને એમના જેવું જ ભણાવતો થઈ ગયો હોય એ જોઈને પછી શિવબાબાએ 'ફોલો ફાધર' કહીને બ્રહ્માના પુરુષાર્થને બિરદાવીને મહોર મારી હોય એવી સંભાવના નથી લાગતી? બાકી ફાધર તો બન્ને છે જ, તો પછી ફોલો કરવાનું પણ બન્નેને હોય જ. કારણ વડા નિશાળિયની આજ્ઞા પણ માસ્ટર સાહેબની આજ્ઞા સમાન જ ગણવાની હોય છે. અને એવી નિરાંત શિવબાબાએ પણ બહાર (તનની બહાર) જતી વખતે રાખી, તેથી બ્રહ્માએ કોઈ ખામી પણ પડવા દીધી નહોતી. તો પણ કયારેક કોઈક પ્રશ્નના ઉત્તરમાં 'શિવબાબા વતાએંગે, ઉનકો પૂછવા લેંગે।' એવા શર્દો નમ્રતાવે બ્રહ્માબાબાએ કહ્યા પણ છે. આટલી ચર્ચા બન્ને એક જેવાં હોવા છતાં બન્નેનું અસ્તિત્વ તો અલગ અલગ હતું જ. એક (બ્રહ્મા) મહાન પુરુષાર્થી

આત્મા હતા, ત્યારે તેમાં દિવ્ય કર્તવ્ય કરાવી રહેલ (શિવ) સ્વયમ્ભુ સર્વશક્તિવાન પરમાત્મા હતા. એ હસ્તિઓ તો હતી જ ને? તો ફોલો પણ બન્નેને કરવાના ને? કારણ બન્નેના પાઈ તો અલગ જ છે ને? છે તો બન્ને 'ફાધર' અને બન્ને એકબીજાનો મહિમા પણ કરતા રહે છે.

'અપને હર કર્મ કો ચરિત્ર સમાન બનાયા હૈ? જો કર્મ યાદ મેં સ્થિત રહકર કરતે હૈને, વહ કર્મ યાદગાર બન જાતા હૈ।'

'ચરિત્ર સમાન' અર્થાત્ મહાન દેવતા સમાન - ચાદગાર. બ્રહ્મા આ પુરુષાર્થ કરીને 'અવ્યક્ત' - 'કર્મતીત' સ્થિતિએ પહોંચ્યા. તેમના સમાન ચાદગાર મૂર્ત યા કર્મયોગી આપણે બનવાનું છે. બાકી શિવબાબાને કર્મયોગી બનવાનું હોતું નથી. બ્રહ્માબાબા તો કર્મયોગી, નિરંતર યોગી, સ્વત: યોગી, સહજ યોગીનું પ્રેક્ટીકલ સ્વરૂપ 'ઉદાહરણમૂર્ત' બની ગયા. આમ 'પુરુષાર્થ' માટે બ્રહ્મા બાપને ફોલો કરવાનું શિવબાબા કહે છે. આ માટે 'કર્માના આકર્ષણાથી પણ પરે'ની કર્મતીત અવસ્થા ફોલો કરવાની છે. સર્વ આકર્ષણાથી અતીત. આ છે સદા જ્ઞાન સ્વરૂપની અવસ્થા. આ માટેની શરૂઆત, 'સ્વયમ્ભુના રાજા' અર્થાત્ સ્થૂળ અને સૂક્ષ્મ કર્મન્દ્રિયોના સ્વામી બનીને કરવાની છે.

શિવબાબા તો 'અવ્યક્ત' છે અને 'અવ્યક્ત વતનવાસી' પણ છે. એવા આપણે પણ 'ਬાપ કે સમાન અવ્યક્ત ઔર અવ્યક્ત વતન વાસી બનના હૈ।' બ્રહ્મા બન્યા. આપણે સર્વ વત્સોએ પણ બનવાનું છે. આ આદેશ, આ આજ્ઞા કોની? શિવબાબાની નિરાકાર જ્યોતિ સ્વરૂપ તો શિવબાબાને ફોલો કરવાના ને? 'આજ્ઞા' અને 'આદેશ' અર્થાત્ 'શ્રીમત' માટે શિવબાબાને ફોલો

કરવાનું સ્વચ્યમ્ સ્પષ્ટ જ છે. આજ્ઞા-આદેશ યા શ્રીમતનું ઉચ્ચારણ ‘માત્ર’ - બ્રહ્મામુખ (અર્થાત् માઈક) કરે છે. જ્યારે પુરુષાર્થમાં, ગુણો અને શક્તિની ધારણા માટે ઉદાહરણમૂર્ત એવા બ્રહ્માબાબાને ફોલો કરવાની વાત પણ કેટલી સ્પષ્ટ છે? શ્રીમત બ્રહ્માની નહિં, શિવબાબાની છે. બ્રહ્મા પણ તેને અનુસરે છે. તો બન્ને બાપને ફોલો કરવા, બન્નેની હસ્તી, બન્નેનું કર્તવ્ય, બન્નેનો પાર્ટ સ્પષ્ટ સમજવો. યજ્ઞ વત્સ માટે, હર પુરુષાર્થી માટે ખૂબ જ આવશ્યક છે. કારણ નિશ્ચય-બુદ્ધિ પણ આ વિચિત્ર પાર્ટની સંપૂર્ણ સમજમાંથી જ ઉત્પન્ન થાય છે. (‘ભાગન્તિ’ના કારણો આ પાર્ટની સમજ નહિં હોવામાં રહેલાં છે.)

‘જો સદૈવ બાપ કે લવ મેં લીન, જ્ઞાન, પ્રેમ, સુખ, શાંતિ, આનંદ કે સાગર મેં સમાયે રહતે હૈ, વહ બચ્ચે સદૈવ બાપ કે સમીપ હૈ।’ આ માટે નિરાકાર-શિવબાબાને ફોલો અર્થાત् અવ્યક્ત બાપની શ્રીમત-આજ્ઞા-આદેશનું પાલન. બ્રહ્માબાબા પણ કહે છે, ‘મૈ તો સિર્ફ દલાલ હુંનું। બરસા તો બાપ સે મિલેગા તો ઉનકો (શિવબાબા) હી યાદ કરના હૈ। મુઢે (બ્રહ્મા) યાદ કરનેસે કુછ નહીં મિલેગા।’ શ્રીમતનું પાલન યા આદેશનું પાલન કરીએ - એ પણ ‘ફોલો’ કહેવાય. ‘માનના ઔર ચલના’ ક્યા? - શ્રીમત. અને શ્રીમત તો છે શ્રેષ્ઠ તે શ્રેષ્ઠ - શિવબાબાની. ‘શ્રીમતનું આચારણ’ અર્થાત્ ફોલો ફાધર. ફોલો શ્રીમતને કરીએ, તો પછી વચ્ચે ‘બ્રહ્મા’ને યાદ શા માટે કરવા? કેવી રીતે ફોલો થવું? કોઈ નમૂનો - એકજ્ઞામ્પલ જોઈએ તો ખબર પડે - સરળ પડે ને? એ અર્થમાં જ બ્રહ્માબાબાનો પુરુષાર્થ જોવાનો છે. સ્ટડી કરી સ્ટુડન્ટ બનવાનું છે. બાકી ‘બાપને ફોલો’ અર્થાત્ સાગરને ફોલો ‘બાપ કે સમાન અવ્યક્ત બનના હૈ।’ ‘સાગર અર્થાત્ સમ્પન્ન બાપ કે

બચ્ચે।’ - જો ‘સાગર’ને ફોલો થઈશું તો ‘ખુશી અખૂટ-અખંડ-અવિનાશી રહેગી.’ નિરાકાર બાપને ફોલો અર્થાત્ નિઃસંકલ્પ, નિરાકારી, નિરહંકારી, નભ્રચિત બનના. ‘બાપ’ સમાન અર્થાત્ ‘બીજ’ની અવસ્થાની પ્રાપ્તિ માટે તો ‘નિરાકાર’ની સ્મૃતિ અને તેના આદેશનું રિગાર્ડથી પાલન આવશ્યક છે. ‘બ્રહ્મા’ કોને ફોલો થતા હતા? શિવબાબાને. માત્ર ‘નિરાકાર’ને જ નહિં પરંતુ સ્વચ્યમના સંપૂર્ણ સ્વરૂપને પણ બ્રહ્મા ફોલો કરતા હતા. ‘કોઈ સફેદ પોશધારી, દિવ્ય પ્રકાશધારી આકાર. મને પોતાની પાસે બોલાવે છે.’ નાની સંદેશી (ગુલગારબેન) ‘આ કોણ હશે?’ - એ પ્રશ્નનો ઉત્તર ખુદ સાકાર બ્રહ્મા પાસેથી પણ મેળવી ન શકી. બ્રહ્માએ કહ્યું, ‘કરી વાર જુએ તો તેમને જ પૂછજો.’ અને તે દિવ્ય આઙૃતિએ ઉત્તર પણ આપેલો, ‘હું બ્રહ્માનું સંપૂર્ણ સ્વરૂપ છું.’ - ત્યારથી પુરુષાર્થી સાકાર બ્રહ્મા પણ સ્વયંના આ સંપૂર્ણ લક્ષને ફોલો કરતા થયા - અનુસરતા અનુસરતા આગળ વધતા રહ્યા. વચ્ચે વચ્ચે પૂછતા રહ્યા - બ્રહ્માએ જ્યારે તન છોડ્યું ત્યારે તેવી દિવ્ય-પ્રકાશમય, અવ્યક્ત સ્થિતિની પ્રાપ્તિ કરી લીધી હતી.

આમ સ્વયંના સંપૂર્ણ સ્વરૂપને (અવ્યક્ત ફરિશ્તાની અવસ્થાને) પણ લક્ષમાં ચાખી તેને પણ ફોલો કરવાની છે.

‘ફોલો ફાધર’ અર્થાત્ શ્રીમતનું પાલન. એટલે કે પારલૌકિક પિતાની આજ્ઞા (અને જ્ઞાન)નું અનુસરણ .... અલૌકિક બાપ (બ્રહ્માબાબા)ના પુરુષાર્થનું પણ અનુસરણ અને સ્વયંના સંપૂર્ણ સ્વરૂપનું પણ અનુસરણ.


॥ ઓમશાંતિ ॥



## સ્નેહ, સાહસ અને રમણીકતાની પ્રતિમૂર્તિ -

### દાદી મનોહરદ્યન્દ્રાજુ

**બ્ર.કુ. હેમંતભાઈ, શાંતિવન, આબુરોડ.**



જમુનાનો કિનારો સુમસામ સ્થાન, ફક્ત બે દીવાલ, તૂટેલુ મકાન, એમા ફક્ત બે બહેનો, રાત્રે એક સૂર્ય જાય ત્યારે બીજુ બહેન ચોકી કરે (પહેરો આપે) એક પહેલવાન એમને જુએ છે કે, ધાર પર આ બહેનો કોણ છે? જેને ડર નથી લાગતો, માનો યા ના માનો આ દેવીઓ જ છે, આવુ વિચારી સુરક્ષા માટે ચોકી કરે, જાણે પ્રભુ દ્વારા પ્રેરણા મળી હોય ! બહેનો વિચારતા આ ભાઈ ચોકી કેમ કરે છે? પહેલવાને વિચાર્યુ, જો હું કુશ્ટી જીતીશ તો માનીશ કે જે બહેનોની હું સેવા કરું છું તેઓ સાચી દેવીઓ છે, નહીં તો નહીં માનીશ અને અદ્ભુત આશ્ર્ય ! તે કુશ્ટી જીતી જાય છે અને સાધિઓની સાથે ખુશીમાં ઝુમતા આવી અને બહેનોની સમક્ષ નત મરટક થઈ અને એમને 20 રૂપિયા, દૂધ, ધી અને ખાંડ વગેરે સામગ્રી પ્રસાદ રૂપે ભેટ કરી. ચારે તરફ આ સમાચાર ફેલાઈ ગયા. તો જ્ઞાન સાંભળવા લોકોની ભીડ થવા લાગી. તેમાં એક નામીગ્રામી માતા પણ આવતા હતા. જેણે પોતાની ધર્મશાળામાં કમરો આપ્યો અને સત્સંગ ચાલવા લાગ્યો. દિલ્હી દરબારથી સેવાના શ્રીગણેશ કરનાર બે તપસ્વી દેવીઓ હતા, દાદી મનોહરદ્યન્દ્રાજુ અને ગંગે દાદીજી. બધુ જ સમર્પણ કરી સેવાનો ઈતિહાસ રચનાર દાદી મનોહરદ્યન્દ્રાજુની કુર્ભાનીની કહાની આજ પણ પ્રેરણાનો પ્રકાશ આપી સેવામાં જુ જાન લૂટાવવાનું શીખવે છે.

દાદી મનોહરદ્યન્દ્રાજુનો લૌકિક જન્મ સન્ન 1924માં સિંધી હૈદ્રાબાદમાં સંપન્ન પરિવારમાં થયો. દાદીને માત-પિતા દ્વારા મળેલ નામ ‘હરી’ હતું, શિવપિતા દ્વારા અલોકિક નામ મળ્યું મનોહરદ્યન્દ્રા. બાબાનું ઘર નજુક હોવાથી દાદીને ત્યાં આવવા જવાનું થતું હતું અને બાબાના ઘરનું આશ્રમ જેતું સાત્ત્વિક વાતાવરણ ખૂબ આકર્ષિત કરતું, એક દિવસ બાબાના ઘરેથી આવતો મધુર ઓમ ધ્વનિનો અવાજ દાદીને અંદર ખેંચીને લઈ ગયો. અને પ્રભુ પ્રેમમાં મગન નર-નારીઓનું દિવ્ય દ્રશ્ય જોઈ તેઓ ભાવવિભોર થઈ ગયા. રોજ જ્ઞાનામૃત પાન કરવા લાગ્યા. 12 વર્ષની ઉમરમાં ઓમ મંડલીમાં પગ મૂક્તા જ એમના જીવનમાં જાણે આશાઓના અસંખ્ય દીપ જગમગી ઉઠ્યા, ત્યાં દાદી કલાકો શાંતિ સમાધી અવસ્થામાં બેસી જતા એ જ સમય દરમિયાન પિતાનું અવસાન થયું. તો પરિવાર પર દુઃખોના પહાડ તૂટી પડ્યા, ત્યારે દાદીએ આત્માનું અમરતાનું જ્ઞાન સંભળાવી સાંત્વના આપી, બધા પર નિર્મોહી સ્થિતિની અમિટ છાપ છોડી.

દ્વાની રંગમાં રંગાયેલા દાદીનું આ અલોકિક પરિવર્તન પહેલા તો માને ખૂબ ગમ્યુ, જેનાથી દાદીની દ્વાની ચાત્રા 6 માસ તો સરળતાથી ચાલી, પરંતુ સંબંધીઓના ભડકાવવાથી મા વિરોધી બની ગઈ. એમણે વિચાર્યુને બેટી જ્ઞાનમાં ચાલતી રહેશે તો સન્યાસી બની જશે. એ સમયે ભાંતિ ફેલાયેલી હતી કે ઓમમંડળીમાં હિન્દોટાઈજ કરે છે. જેથી ભ્રમિત થઈને મા વિધન રૂપ બનતી. માર-પીટ કરી

તાળામાં બંધ કરી દેતી. એક દિવસ માઅ જીવનનું લક્ષ્ય પૂછ્યું અને કહ્યું સમાજમાં રહેવું હોય તો લગન કરવા પડશે. પરંતુ દાઈએ તો પ્રભુને જ પ્રિયતમના રૂપમાં સ્વીકાર કરી લીધા હતા. જ્યારે વિકારી પુરુષ સાથે વિવાહ કરવાનો ઈન્જાર કર્યો તો લોકલાજ વશ મા હેરાન કરવા લાગી. ભલે તન બંધનમાં હતું પરંતુ મન મનમીતની યાદમાં મગન રહેતું. મા જોટલી હેરાન કરતી એમ દાઈની લગન વધતી અને દિવ્ય અનુભવ થતા. વિઘ્નોને પાર કરી, સ્નેહ અને સહનશીલતાની શક્તિથી માનું દિલ જીત્યું અને મા ડારા સ્વીકૃતિ પત્ર લઈને 1936માં ઓમ મંડળીમાં દાખલ થયા અને 1937માં સમર્પણ થયા.

બહુબાબાના મર્સ્ટકમાંથી નીકળતું દિવ્ય તેજ દાઈને પોતાની તરફ આકર્ષિત કરતું તથા બાળકોની વચ્ચે ઊભેલા બાબાનું રહાનિયતથી ચમકતું મુખમંડળ જોઈ એમને લાગતું, કે સિતારોની મહિંકિલમાં ચંદ્રમા ચમકી રહ્યો હોય. બાબા પાસેથી સાચું ગીતા જ્ઞાન સાંભળી મહાન બનવાની પ્રેરણા મેળવી તેઓ રહાની યાત્રા પર નીકળ્યા, દાઈને જ્ઞાન-અદ્યયન અને મનન-ચિંતનનો ખૂબ શોખ હતો. બાબા નિબંધ લખવા આપતા તો દાઈ તુર્ચંત જ લખીને આપતા અને ઓજસ્વી વાણીમાં જ્ઞાન સંભળાવતા આવી વક્તવ્યની કળાને કારણે બાબા કહેતા, ‘આ બચ્ચી તો જ્ઞાનગંગા છે, શેરની છે.’ ઈશ્વરીય પઢાઈની લગનને કારણે દાઈના જીવનમાં પ્રગતિના પંખ લાગ્યા અને એમણે 10-15 બહેનો સાથે મળીને સ્વઉંનિતિનું ગ્રૂપ બનાવ્યું. જેને બાબા ‘મનોહર પાર્ટી’ કહેતા. જ્યારે લૌકિક સંબંધી પૂછતા ‘આપ ક્યારે પાછા આવશો?’ તો દાઈ કહેતા આ અમારો 14 વર્ષનો વનવાસ છે એ જ 14 વર્ષની મહાન તપસ્યા ભણીમાં તપીને તેઓ નિર્ભય

શિવ-શક્તિ બન્યા. એજ સમય દરમિયાન ભારત-પાકિસ્તાન વિભાજનમાં થયેલ વિનાશકારી નર-સંહારમાં સુરક્ષિત રહ્યા કેમ કે રહાની દ્રષ્ટિથી પોતાનાપણાની ભાસના આપનાર દાદી મુસલમાન ભાઈઓને પણ ખુદાઈ બિદમતની ભાસના આવતી.

સન 1950માં આબુમાં આવ્યા પછી બાબાએ આંદેશ આપ્યો. ‘ચેરિટી બિંગિન્સ એટ હોમ, (પહેલા પરિવારનું કલ્યાણ કરો)’ અને દાદી લૌકિક સંબંધીઓના નિમંત્રણ પર સેવામાં ગયા. મંદિર ગુરુદ્વારોમાં સત્સંગ હેતુ નિમંત્રણ મળવા લાગ્યા. દિલ્હીમાં ચાંદની ચોકમાં ગૌરીશંકર મંદિરમાં જ્ઞાનથી પ્રભાવિત થઈ ટ્રસ્ટીઓએ કમરો આપ્યો. શિવબાબાની કમાલથી આવવાવાળા ભાઈ-બહેનોને સાક્ષાત્કાર થવા લાગ્યા. એથી ભમિત થઈ ટ્રસ્ટીઓએ પોતાનો પ્રબંધ કરવાનું કહ્યું અને તેઓ જમુનાના કાંઠે ચાલ્યા ગયા. (લેખની શરૂઆતમાં લખેલી જમુના કિનારાની ઘટના બાદ) સેવા સફરની શરૂઆત થઈ. ઈશ્વરીય મદદથી સત્સંગમાં સાક્ષાત્કારની ધૂમ મરી, જેની ખબર ઈંડિરા ગાંધી સુધી પહોંચી, એમણે ચાર માતાઓને સી.આઈ.ડી. બનાવીને મોકલ્યા. માતાઓના સ્વપરિવર્તનના અનુભવ સાંભળી તેઓ પાછા ચાલ્યા ગયા. પંડિત નેહરજી અને ઈંડિરા ગાંધીને છલ-કપટ રહિત નિઃસ્વાર્થ સેવાના શુભ સમાચાર આપ્યા. એક મહિના પછી દાદી પાછા આવ્યા તો બાબાએ કહ્યું, ‘બચ્ચી, જ્ઞાન રત્નોની એક પણ દુકાન ના બની!’ તો દાઈએ કહ્યું, બાબા નવા જ્ઞાનમાં ખૂબ વિઘ્ન પડે, મકાન ના મળે, તો બાબાએ કહ્યું, ‘બચ્ચી, ધીરજ રાખો ગાતી ગલીમાં 108 થી વધુ સેન્ટર ખુલશે.

બાબા પાસેથી વરદાન લઈને સેવા ગગનના ઉડતા પંછી બન્યા અને દિલ્હી, પંજાબ, હરિયાણા,

ઉત્તર પ્રદેશ તથા અનેક સેવાકેન્દ્ર ખોલ્યા. શરૂઆતમાં થયેલા કઠિન વિરોધનો નિર્ભય બનીને સામનો કર્યો. નવા જ્ઞાનનો પ્રચાર માટે પરીક્ષાઓનો સ્વીકાર કરી સેવાક્ષેપ્રમાં મક્કમતાથી અડગ રહી વિઘ્નોનો એક બલ એક ભરોસાથી પાર કર્યા. સાધન, સુવિધાનો અભાવ હોવા છતાં દાઈ જ્યાં પણ ગયા દૃઢ નિશ્ચય, લગન, સ્નેહ, સાહસ, સાદગી, સહનશીલતાની શક્તિથી સેવામાં ચાર ચાંદ લગાવ્યા, એક દિકથી બાબાના બનાવવાની કળામાં માહિર દાઈ હુંમેશા બધાને મારા તો એક શિવબાબા બીજુ કોઈ નહીં. એ પાઠ ભણાવતા. બાંધેલી માતાઓને સ્નેહ આપી આગળ વધારતા. વિશેષ કરનાલમાં લાંબા સમય સુધી સેવા કરી અનેક કંન્યા રત્નોને પ્રેરણા આપી આપ સમાન બનાવ્યા અને ઈશ્વરીય પથ પર ચાલતા શીખબ્યું. જે આજે પણ અનેક સેવાકેન્દ્રોનું કુશલ સંચાલન કરી રહ્યા છે. દાઈએ જ નાગપુરના દિવંગત પુષ્પાર્ચાની દીદીના પરિવારને પણ સમર્પિત કરાવ્યા.

બ્રહ્માબાબા અવ્યક્ત થયા તો દાઈ 1970માં મુખ્યાલય આબુ આવી ગયા. દીદી મનમોહિની એમને કહેતા અહીં આદર્શ ટીચર બનીને રહેશો તો સત્યુગમાં શ્રીકૃષ્ણાના ટીચર બનશો. દાઈ હીરાના વ્યાપારી દાદા લેખરાજ થી પ્રજાપિતા બ્રહ્મા બન્યા. ત્યાં સુધીનાં સફરના સાક્ષી હતા. એટલા માટે જ ઓજસ્વી ધારા પ્રવાહ વાણીમાં હર ઘટના હુબહુ વર્ણન કરી ચઙ્ગ ઈતિહાસના પ્રત્યેક દ્રશ્યને અંખોની સામે બખૂબી ઉભુ કરી દેતા. દાઈ ઓમ મંડળીથી વિશ્વ વિખ્યાત બનેલા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયની વિશાલ સેવાશૂંખલાને રોચકતાથી વર્ણન કરી ચલચિત્રની જેમ પ્રસ્તુત કરી આપતા. એમના ભાષણમાં સાધારણ શાબ્દોમાં પણ ભાસના આપવાની

ગજબની જાદૂઈ શક્તિ હતી. દાઈ કુશળતાથી ટીચર્સ ટ્રેનિંગ કરાવતા. દાઈ બ્રહ્માકુમારીઝના મેનેજમેન્ટ ગવર્નિંગના સભ્ય તથા રાજ્યોગ એજચ્યુકેશન અને રિસર્ચ ફાઉન્ડેશનના સભ્ય પણ હતા. રાજ્યોગ શિબિરોના દાઈ નિર્દ્દિશિકા રહ્યા. દાઈ ચંદ્રમણિઝના દેહ ત્યાગ પછી તેઓ 1997થી જ્ઞાન સરોવરના ડાયરેક્ટર બન્યા. આપ મહિલા પ્રભાગના રાષ્ટ્રીય અદ્યક્ષા પણ હતા.

પરમાત્મ ખજાનાના ખાસ રત્ન દાઈ ખૂબીઓની ખાણ હતા. એમના વિરાટ વ્યક્તિત્વના વિલક્ષણ વિશેષતાઓને શાબ્દોના સાગરમાં સમાવવાનું કઠિન કાર્ય છે. દાઈ વ્યક્તિ, વસ્તુ, વૈભવના લગાવથી મુક્ત રહ્યા. શ્રીમતનું એક્યુરેટ પાલન કરી આદર્શ આચરण કરવાનું શીખવતા. દેહ દુનિયાથી જ્યારા રહી પ્રભુપિતાના જ્યારા બની, સર્વ પર સ્નેહની વર્ષા કરતા અને રહાની (આનિક) પાલના આપી પોતાનાપણાનો અનુભવ કરાવી જ્યારમાં સમાવી લેતા. એમની મિશ્રી (ખાંડ)ની મીઠાશ મેળવી રસીલી વાણી દરેકને દાઈના દિવાના બનાવી દેતા. મધુરતાથી રહાની જ્ઞાન સંભળાવી મનના દુઃખ હરીને મનોહર નામ સાબિત કરતા. જેવી રીતે બધા જ શાકમાં બટાકા સહજ સમાઈ જાય એવા જ મિલનસાર દાઈ નાના-મોટા બધા સાથે હળી મળી જતા. તેઓ ત્યાગના મહામેરુ, તપસ્યાના પ્રતિમૂર્તિ તથા સેવાક્ષેપ્રમાં ધૂવ તારા હતા. સેવામાં હુંમેશા એવરરેડી રહેતા. જ્યાં પણ બાબા કહે, દાઈ ખુશી ખુશીથી જતા તો બાબા એમને ‘બહુરૂપી અને ચક્રવર્તી’નું ટાઈટલ આપતા તથા નામ સહિત ચાદ કરી મુરલીમાં એમનું દ્રષ્ટાંત આપતા.

પહેલી વાર મધુવન આવ્યો તો ઉમર નાની હતી પરંતુ દાઈની સિંદ્હી મિશ્રિત હિંદી અમને ખૂબ જ્યારી લાગતી, દાઈ કહેતા બ્રહ્મા ભોજન વેસ્ટ ન

થવું જોઈએ. એટલા માટે થોડું થોડું વ્યો, કર્મની ગતિ સમજાવતા કહેતા, જુઓ પૂછ્યા વગર કોઈનું તેલ, સાખું અથવા કોઈ ચીજ લેશો તો એમના સંકલ્પ ચાલશે તમારા હિસાબ કિંતાબ બનશે. બતાવ્યા વગર લેવું ચોરી છે, એટલે પૂછીને લેવું. દાઈ કહેતા, મધુવનમાં બે જ કામ છે. કલાસ અને ગલાસ એટલે કે ચાચ, દૂધનો ગલાસ પીએ અને કલાસ કરો. અને માતા-પિતાના ઘરમાં બેફિકર બનીને રહો. મને આત્માને અનેક વાર દાઈના નિરછલ, નિર્મલ, નિઃસ્વાર્થ ચ્યારના ઝરણામાં સ્નેહ સ્નાનનું સૌભાગ્ય મળ્યું. જ્યારે દાઈ આભિકતાથી ‘હેમન-હેમન (હેમંત)’ કહીને બોલાવતા, તો એમના ચ્યારની કુવાર આત્માને ઠંડક આપતી, મનની કલીયા ખીલી જતી અને રોમ-રોમ પુલકિત થઈ ઉઠતા. મધુનના પ્રાંગણમાં મધુવન નિવાસીઓ સાથે બેસી હસી મજાક કરી તાજગીથી ભરપૂર કરી દેતા. તો એમના રહાની રમણિક અંદાજથી મનોહારી રૂપના દર્શન થતા.

(પેજ નં. 18નું અનુસંધાન)... વિઘ્નોનું કારણ લોકોને એમના જીવન પરિવર્તનની પ્રત્યક્ષ ઝલક જોવા મળે છે. તેઓ બજારમાં જઈને ફળ ખરીદે છે પણ ત્યાંની આઈરક્જીમ તથા મિઠાઈઓ જેવી ચીજો ઉપર દૃષ્ટિ પણ ફુંકતા નથી. ઈંડા, લસણ તથા ચ્યાજથી હવે એમને દુર્ગંધિ આવવા લાગે છે. આ છે વિદેશીઓના મહાન પરિવર્તનની તરફીર...

તેઓ સ્વીકારે છે કે તેઓ પહેલાં ભારતીય હતા. કોઈ કારણોથી તેઓ વિદેશ ચાલ્યા ગયા હતા. હવે પોતાની માતૃભૂમિમાં પાછા આવ્યા છે. સ્વર્યંને ભારતીય સંસ્કૃતિ કેટલી મહાન છે. અહીંની શાંતિ એમને અહીં ખેંચી લાવે છે. અહીંના મનુષ્યોની રોનક એમને અહીંના ચથાર્થ સ્વરૂપનો આભાસ આપે છે. તો વિંકારોની ખાઈમાં પડેલા આ લોકોને પવિત્રતાનું બળ મળ્યું. રાજ્યોગના

આવી મોટી હસ્તી હોવા છતાં પણ દાઈ પ્રકાશમણિજીની સમક્ષ એમણે નાની બચ્ચી સમાન આજ્ઞાકારી બનીને હર સેવામાં હાં-જી, હાં-જી કરતા જોયા.

યોગ શક્તિથી સ્થિત પ્રજા બની દાઈએ અસંહનીય બીમારીમાં પણ કર્મયોગથી કર્મભોગ પર હસ્તા-હસ્તા વિજય મેળવ્યો. કેમ કે અંતિમ ક્ષણોમાં શરીર તો સાકાર વતનમાં હતું પરંતુ રહ (આત્મા) તો બાબાની સમીપ સૂક્ષ્મવતનમાં મૌલાઈ મસ્તીનો અનુભવ કરી રહી હતી. બાબા એમના દિલની હર આશ વતનમાં પૂર્ણ કરી રહ્યા હતા. આભિર 17 નવેમ્બર 2008ના દિવસે પૂર્ણાંશું શરીર ત્યાગ કરી તેઓ ફર્શથી અર્શ નિવાસી ફરિસ્તા બન્યા અને ગુપ્ત રૂપમાં સ્વર્ણિમ સંસારની સ્થાપના હેતુ એડવાન્સ પાર્ટીમાં સેવાર્થ રવાના થયા.

॥ ઓમશાંતિ ॥

**અનુવાદ:** બી.કે. મૃદુલા કુતિયાણા, પોરબંદર.

અભ્યાસથી રાજ્યોગ દ્વારા થયેલી સુખદ અનુભૂતિઓથી એમના મનમાં ભૌતિકતા પ્રત્યે નીરસતા જન્મી છે. જે મનુષ્યને બ્રહ્મચાર્યના સુખનો સહજરૂપે અનુભવ કરાવે છે. એ સત્ય છે કે ઈશ્વરીય શક્તિ વગરના આ પ્રકારનું જીવન પરિવર્તન લગભગ અસંભવ છે.

દેશવિદેશના ભાઈબહેનો ઈશ્વરીય જ્ઞાન ધારણ કરશે તો લોકોને એમના ચહેરાઓ ઉપર દિવ્યતાની ઝલક જોવા મળશે. ત્યાગ, તપસ્યાથી ઓતપ્રોત એમનું જીવન જોશે તો ત્યારે અવશ્ય એમને આ મહાનતમ ઈશ્વરીય શક્તિનો આભાસ થશે ત્યારે એમના મુખથી નીકળશે અહા! જે પ્રકાશથી સમસ્ત વિશ્વ પ્રકાશિત થઈ ગયું. એ દીવા નીરે બેસવા છતાં પણ આપણું મન તો અંદાજારમાં જ રહી ગયું.

॥ ઓમશાંતિ ॥

## દિવદર્શન

# અલોકિક દીપોત્સવ

**બ્ર.કુ. નંદિની, સુખશાંતિ ભવન, મહિનગર, અમદાવાદ.**

આસો મહિનો એટલે વિવિધ તહેવારોનો મેળો. અગિયારસથી જ દિવાળીના દિવસોની શરૂઆત થાય. અગિયારસ, વાઘબારસ, ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, નવું વર્ષ, ભાઈબીજ, લાભપાંચમ, તુલસી વિવાહ અને દેવ દિવાળી. દિવાળી એટલે પ્રકાશનું પર્વ સમગ્ર ગુજરાતમાં ૧૫-૨૫ દિવસ આનંદ, હર્ષ અને ઉત્સાહથી ઉજવાય છે. વર્તમાન સમય પુરખોત્તમ કવ્યાણકારી ચુગમાં દિવાળીનું પર્વ આપણા સૌ માટે એક સકારાત્મક સેંદેશ લઈને આવે છે. જેમાં દિવાળી નજીક આવતી જાય છે તેમ આપણા સૌના મનમાં દિવાળી તહેવારની તૈયારીઓ ખૂબ આનંદથી કરવા લાગી જઈએ છીએ. એક જનસામાન્ય વ્યક્તિ દિવાળીનો તહેવાર લોકિક ચીતદ્વિબાજો અનુસાર ઉજવે છે. મોટે ભાગે લોકો ઉજસના પ્રતીક સમા દિવાળીના તહેવારની પૂર્વ ઘરનાં ખૂણે-ખાચરેથી માટી, ધૂળ, કચરો જૂની તૂટેલી ચીજ વસ્તુઓને દૂર કરી સાફ-સફાઈ કરી, ઘરનું સુશોભન કરી, મીઠાઈ બનાવી, સ્થૂળ માટીના કોડિયામાં તેલ-ધીનો દીવો પ્રગટાવી અજવાણું કરે છે. જ્યારે ઈશ્વરીય જ્ઞાનને જીવનમાં અપનાવનાર વિદ્યાલયના બાળકો આત્મા રૂપી ધરમાંથી અજ્ઞાનતા, ખામીયોને દૂર કરી અંતર મનની સફાઈ કરે છે. આદ્યાત્મિકતા દ્વારા આત્માને સભાવી, જ્ઞાનામૃત દ્વારા મીઠાશ ભરી, આત્મ કોડિયામાં ઈશ્વરીય જ્ઞાનનો દીવો પ્રગટાવી અલોકિક દીપોત્સવ ઉજવે છે. પરમાત્માને ઓળખનાર સૌભાગ્યશાળી આત્માઓ દિવાળીને આદ્યાત્મિક, અલોકિક આનંદ અને ખુશીઓ

સાથે મનાવે છે.

આજે જગમગતા દીપકોનો સૌથી મોટો તહેવાર દિવાળી છે. આપણ સૌ જાણીએ છીએ કે દર વર્ષ શારદીય નવરાત્રી અને શરદપૂનમ પછી દિવાળીનો તહેવાર ઉજવાય છે. જ્યારે દેહ અભિમાન રૂપી દેવ્યાનો નાશ થાય છે ત્યારે સૃષ્ટિ પર દેવી-દેવતાઓનું આગમન અને નવયુગની શરૂઆત થાય છે. નવયુગમાં દેવી-દેવતાઓની રાજધાનીમાં રાજ્યાભિષેક અર્થાત કોરોનેશન દિવસ - દિવાળી તરીકે મનાવાય છે. ત્યાં જગમગતા દીપનો તહેવાર એટલે કે સ્વહિમ સત્યાગી દુનિયાનું યાદગાર પર્વ કોરોનેશન દિવસ છે. જ્યાં દરેક દેવી-દેવતા આત્મિક સ્થિતિમાં સ્થિતપ્રણ છે.

દાર્મિક ઈતિહાસ પ્રમાણે આ પાવન પર્વને સૌ કોઈ જુદી-જુદી યાદગારના રૂપે મનાવે, કોઈ શ્રીરામના રાજ્ય અભિષેકના યાદગાર રૂપે મનાવે છે. તો કોઈ તેને સમુદ્ર મંથન દ્વારા શ્રી લક્ષ્મીને સમુદ્ર મંથન દ્વારા બહાર નીકળ્યા તેમ પણ કહે છે. કોઈ વળી નરકાસુર રાક્ષસનો વધ કર્યાના સ્વરૂપે, વળી કોઈ મહાવીર સ્વામીના નિવાણિ દિવસના સાક્ષીનો તહેવાર જ્યોતિનું પર્વ દિવાળી બનેલ છે. પરંતુ વર્તમાનમાં આ તહેવાર માત્ર વૈભવોનું પ્રતીક સમાન મહાલક્ષ્મીના પૂજનના રૂપે સંપૂર્ણ અર્પિત છે. દિવાળીમાં ચોતરફ સર્વત્ર શ્રી લક્ષ્મીની સાથે-સાથે શ્રી ગણેશ અને શ્રી મહાસરસ્વતીની પૂજા પણ કરવામાં આવે છે, કારણ કે મનુષ્યને ધનની સાથે સંબુદ્ધ અને સંદર્ભિત તો જરૂર જોઈએ. સામાન્ય માટીમાંથી

બજેલા સાધારણ દીવડામાં જ્યારે તેલ-ધી, દિવેટ મૂકી પ્રગટાવતા સૌ કોઈ દીપકને પગે લાગે છે. આ દીપક પર ધન, વિવિધ પ્રકારના ખાદ્ય પદાર્થો, ફળ, ફૂલ, મીઠાઈ અર્પણ કરવામાં આવે છે. દીપકને સાક્ષી માનીને પ્રતિજ્ઞા પણ કરવામાં આવે છે. પરંતુ જ્યારે દીપકમાં રહેલું તેલ-ધી પૂરું થઈ જાય છે, ત્યારે વાટની જ્યોતિ બુઝાઈ જાય છે. ત્યારબાદ તે દીપકને કર્યારાના ડંબામાં ફુંકી દેવામાં આવે છે. તેવી જ રીતે માનવ શરીર પણ માટીના દીપક જેવું જ છે. અર્થાત્ જ્યાં સુધી આ શરીરરૂપી દીપકમાં આત્મારૂપી જ્યોતિ પ્રગટેલી હોય છે, ઝાનરૂપી ધી આત્મજ્યોતિને નિરંતર જગમગાવતી રાખે છે. ત્યારે તે વ્યક્તિ પૂજનીય બની જાય છે. પરંતુ જ્યારે આત્મા દેહનો ત્યાગ કરે છે ત્યારે માનવ શરીરની ગતિ પેલા માટીના દીપક જેવી થઈ જાય છે. એટલે કે દિવાળી છે - આત્માની જ્યોતિ ઝાનરૂપી ધૂતથી પ્રકાશિત કરી જીવનને પૂજનીય બનાવવાનો ચાદગાર તહેવાર.

આવો આ દિવાળીને અનોખી બનાવવા ભલે તમે દીપક પ્રગટાવો પરંતુ સાથે સાથે સ્વયંની તથા

### (પેજ નં. 08નું અનુસંધાન) ... અમૃતધારા

કંઈ નથી તો શાંતિ, પ્રેમ તો છે, ખુશી તો છે. ચીજો કોઈ હોય, કોઈ ના પણ હોય. આ સર્વ ચીજો તો શાંતિ અને ખુશી આપનારી નથી. પણ બાબાએ જે મને ઝાનદિન આપ્યું છે તે મારી પાસે સદા રહે. દિલથી પ્રેમ આપતા રહો, શાંતિ આપતા રહો. જે કંઈ આપણો પરસ્પરનો લેણદેણનો વ્યવહાર છે તે સર્વ કંઈ બાબાનો જ છે. એમાં આપણું કંઈ નથી. તો સદા સંતુષ્ટ, સુખી, સહનશીલ, શીતળ બની રહેજો.

પ્રવૃત્તિમાં રહેનારા તો પ્રથમ કક્ષા મેળવી શકે છે કારણ કે સંગમ પર દરેકને તક છે. જે

અન્ય આત્માઓની જ્યોતિ પણ પ્રગટાવવાનો પવિત્ર સંકલ્પ અવશ્ય કરીએ. કોઈના પ્રત્યે ક્યાંક ને ક્યાંક મન મંદિરના કોઈ ખૂણે-ખાચરે થોડી પણ ઈર્ષા, નફરત, વેર, ઝેર કે બદલાની કે કોઇની તમસ ભાવનાઓ ને કાઢી નાખીએ. નહિં તો આવી ભાવનાઓ સ્વયંને અને અન્યને ભયભીત પણ કરશે. પરમાત્મા મહાજ્યોતિ સાથે જોડીને જરૂર આવી નકારાત્મક ભાવનાઓને દૂર કરીએ. ચાદ રહે કે જ્યારે અંતરમનમાં દીપક જાગશે, ત્યારે તેના દ્વારા અનેક આત્માઓના દીપક પણ જાગશે. જ્યારે નર્કમય સંસારરૂપી નરકાસુર બદલ્યો ત્યારે થશે સારી આત્મશાબાજુ. જ્યારે સાચા મનથી થશે રાવણાનો અંત, ત્યારે નહિં રહે બીજા અન્ય આત્માઓ માટે અંદર ઈર્ષા, દ્રેષ, ઘૃણાભાવ. ખલાસ જશે જ્યારે તમસ ગુણો, ત્યારે માનવ સારો સંત બનશે અને દરેક ઘરમાં ખુશી આનંદ થશે. ત્યારે કહેવાશે ઉત્સવનો તહેવાર સારી દિવાળી.

॥ ઓમશાંતિ ॥

ઇછે, તે પ્રથમકક્ષામાં આવી શકે. બાબા સૌને એકઠાં ભાણાવે છે. જૂનાઓ કરતાં નવા વિદ્યાર્થીઓ આગળ વધી રહ્યા છે.

કેમણે બાબાના બનતાં જ પોતાના આહાર, વિહાર, વિચારોને શુદ્ધ કરી દીધા તો એને ધારણા કરવામાં વાર લાગતી નથી, જ્યારથી બાબાના બન્યા છીએ ત્યારથી પવિત્રતા જીવનમાં, સત્યતા મનમાં અને નમ્રતા વ્યવહારમાં આવી છે. એકનો બીજા સાથે સંબંધ છે. આ ઉન્નતિનો માર્ગ છે.

॥ ઓમશાંતિ ॥

## વર્ષ ૨૦૨૩ માટે વિશેષ સૂચના

બ્રહ્માકુમારીજ સેવાકેન્દ્રોનાં નિમિત ઇન્દ્રાજ બહેનો, સેવાસાથી બહેનો, બ્રહ્માકુમાર ભાઈઓ-બહેનો તથા સૌ પ્રારં સ્નેહી વાંચકમિત્રો, આપ મંગળ કુશળ હણો, તેવી શુભ આશા છે.

**જાન્યુઆરી - ૨૦૨૩થી ગુજરાતી જ્ઞાનામૃતનું નવું વર્ષ શરૂ થનાર છે. આપ સૌને નમ્ર વિનંતી છે કે, નવા વર્ષ - ૨૦૨૩ માટે આપના સેવાકેન્દ્રોની જ્ઞાનામૃત મેગેગ્રીનની કુલ સંખ્યા જેમ બને તેમ જલ્દીથી તારીખ - ૩૦, નવેમ્બર - ૨૦૨૨ પહેલા.**

જ્ઞાનામૃત કાર્યાલય સુખશાંતિ ભવન,

બ્ર.કુ. નંદિનીબેનને જ્ઞાનામૃતના

Email - gyanamrit.guj@gmail.com

અથવા

હોટસએપ નંબર - +૯૧ ૯૪૨૬૭ ૦૮૪૪૮

**દ્વારા ખાસ લેખિતમાં જાણ કરશોજુ. જાન્યુઆરી - ૨૦૨૩નો અંક ખૂબ એડવાન્સમાં તૈયાર થઈને પ્રિન્ટીંગ માટે પ્રેસમાં અગાઉથી ડિસેમ્બર-૨૦૨૨માં આપી દેવાનો હોય છે. આપ સૌની અથાક મહેનત, પરિશ્રમ અને સહકારથી જ્ઞાનામૃતના અંકોની સંખ્યા અમને ૩૦ નવેમ્બર સુધીમાં એડવાન્સમાં મળી જાય તો પ્રિન્ટીંગમાં વધુ સગવડતા રહે.**

આપ સૌ નિમિત બહેનોને ખાસ નમ્ર અરજ કરવાની કે, બાબાનો સંદેશ જન-જન સુધી પહોંચવાની સેવા માટે આપ આપના કલાસના સૌ ભાઈ-બહેનોમાં ખૂબ ઉમંગ-ઉત્સાહ ભરી સભ્યો બનાવવાનું લક્ષ્ય રાખશો. સેવાકેન્દ્ર અને ગીતા પાઠશાળાના દરેક બી.કે. પરિવારમાં ઘરે બાબાનું ગુજરાતી જ્ઞાનામૃત અવશ્ય જાય તે હેતુથી, બેહુદની સેવા માટે જૂના મેમ્બરોને ચાલુ રાખી, બીજા નવા (ઓછામાં ઓછા) બે-પણ

સભ્યો બનાવી જ્ઞાનદાન કરવાની સેવામાં પોતાનું ભાગ્ય બનાવવાના આ સુંદર મોકાને ઝડપી સેવા કરી લેશોજુ. દરેક બાબાના બાળકો પોતે સભ્ય બની અંક વાંચીને પોતાનો તે અંક બીજાને વાંચવા આપીને દર મહીને જ્ઞાનની સેવા કરવાની તક લે, તેવી પ્રેરણા જરૂર આપશો. તમે સભ્ય બની ૧ વર્ષમાં ૧૨ અંક દ્વારા જુદા-જુદા ૧૨ પરિવારો, પાડોશી, સ્નેહીજનોની સેવા થશે. બીજા નોન-બીકે ભાઈ-બહેનો, મિત્રો, વેપારીઓ, ઓફિસના અધિકારીયો, સમાજસેવી સંસ્થાઓ, મહિલા મંડળ, શાળા-કોલેજ, લાઇબ્રેરીવાળાને જરૂરથી સભ્યો બનાવવાનું લક્ષ્ય ભાઈ-બહેનોને આપશો. સૌ વાંચકમિત્રોને પણ સાદર વિનંતી કે, તમે પણ ઓછામાં ઓછા બીજા ૩ નવા સભ્યો જરૂર બનાવશો.

**વિશેષ કે, જેમ આપ સૌ કોઈ જાણો છો કે છેલ્લા દ મહિનામાં ખાસ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પેટ્રોલના ભાવમાં ખૂબ ધરખમ વધારો થયો છે. જેની અસર જનજીવનના પ્રત્યેક ક્ષેત્રમાં દરેક ચીજ-વસ્તુઓ પર પડી રહી છે. પ્રિન્ટીંગ માટે પરદેશથી આવતો કાગળ, શાહી (ઈન્ક), ટ્રાન્સપોર્ટનું ભાડું, ટપાલ ટીકીટના ભાવ, પરદેશમાં એરફ્યુઅલ સરચાઈ વધવાથી પોસ્ટલ ટીકીટના ભાવમાં સીધો ડબલ વધારો થયેલ છે. આમ દરેક ચીજ-વસ્તુઓમાં ખૂબ જંગી તોતિંગ ભાવવધારો થયેલ જોવા મળે છે. તમે સૌ કોઈ આ સ્થિતિને સારી રીતે અનુભવો છો, સમજુ પણ શકો છો. સૌને એ પણ ખ્યાલ છે કે, મધુબનથી પ્રકાશિત હિન્દી જ્ઞાનામૃત, ઓમશાંતિ મીડિયા, બીજા પ્રકાશનોમાં પણ ચાલુ વર્ષ-૨૦૨૨થી ભાવ વધારેલ છે. આ સમગ્ર**

બાબતોને દ્યાને લેતા વર્ષ જાન્યુઆરી-૨૦૨૩થી ગુજરાતી જ્ઞાનામૃતમાં પણ નજીવો ભાવ વધારો કરવામાં આયે છે. આશા રાખું છું અને વિનંતી છે કે, આપ સૌ તેને સ્વીકારશોજુ. તેમાં સાથ-સહકાર જરૂરી આપશો તેવી નભ અરજી છે.

જ્ઞાનામૃતનું સંપાદન, ડિગ્રીનીંગ, પ્રિન્ટીંગનું કામ નિયમિત રીતે ચાલે છે. મેગ્ઝીન પહોંચાડવા માટે ટ્રાન્સપોર્ટ અને ટપાલ ખાતાની નિયમિત સેવાઓ પણ મળે છે. જેથી આપને દેગ્યુલર જ્ઞાનામૃત મોકલી રહ્યાં છીએ. આપને સમયસર, સારી સ્થિતિમાં, વ્યવસ્થિત રીતે અંકો મળી જતાં જ હશે તેવી જ્ઞાનામૃત ટીમને આશા છે. તેમ છતાં પણ જ્ઞાનામૃત બાબતે આપને કોઈ પણ તકલીફ પડતી હોય, કોઈ સલાહ કે સૂચન હોય તો અથવા કોઈ વાત દ્યાન પર આપવા જેવી લાગે તો તમે ચોક્કસપણે નિઃસંકોચ સીધો સંપર્ક કરશો. મેગ્ઝીનના અંકો આપની અનુકૂળતા પ્રમાણે સેવાકેન્દ્ર ઉપર અથવા જે તે સભ્યોને સીધા તેમના ઘરે ટપાલથી મોકલી શકાય તેવા સરકારના નવા નિયમો પ્રમાણે આયોજન કરીએ છીએ.

આપ સૌ બીજા આત્માઓની સેવા કરી શકો તે લક્ષ્યથી જ્ઞાનામૃત ઈમેલ અને હોટસએપથી પણ મોકલી રહ્યાં છીએ. જ્ઞાનામૃત ઈ-કોપી બી.કે. મેગ્ઝીનની વેબસાઈટ, જુઓ એપ્લિકેશન પર પણ છે.

**આભાર માટે :-** સમગ્ર વર્ષ દરમિયાન આપ સર્વ નિયમિત ટીચર્સ બહેનો, સર્વ નાની મોટી સાથી બહેનો, જ્ઞાનામૃત માટે દરેક સેવાકેન્દ્ર પર નવા સભ્યો બનાવવા, યાદી તૈયાર કરવી, ટ્રાન્સપોર્ટમાંથી લાવવા તેને કલાસમાં, ગીતા પાઠશાળામાં, ગામમાં અન્ય નોન બી.કે. સભ્યોને આપવા જવાની સેવા પૂરી પાડનાર, સમગ્ર વર્ષ દરમિયાન લેખ અનુભવ લખી નિયમિત લખી

મોકલવા, સેવાકેન્દ્રો દ્વારા થતી દરેક સેવાના ફોટા પાડવા અને સમાચાર સાથે સમયસર મોકલવા જેવી ધણી સેવાઓમાં આપ સૌકોઈનો દરેક કાર્યમાં ખૂબ-ખૂબ સાથ, સહકાર અને સપોર્ટ જ્ઞાનામૃતને મળતો આવીયો છે. તે બદલ સંપાદક અને સમગ્ર જ્ઞાનામૃત ટીમ આપનો અંતકરણપૂર્વક આભાર માને છે, અમે આપના અણી છીએ. છેલ્લા પ્રીતિ સુધી બાબાની આ સેવાઓ અવિરત ચાલી રહી છે, ભવિષ્યમાં પણ આપણે સૌ સાથે મળીને જ્ઞાનામૃતની સેવાને આગળ ચાલુ રાખીને વધુ સેવાઓને ધ્યાન રહીએ, તેવી અભ્યર્થના સાથે જ્ઞાનામૃત ટીમ આપ સૌનો અંતકરણપૂર્વક દિલથી ખૂબ-ખૂબ આભાર માને છે.

**તો સમયસર આપની નવા વર્ષની સંખ્યા અમને મળી જશે તેવી શુભ આશા અને પૂર્ણ વિશ્વાસ છે. આભાર સહ.**

॥ ઓમશાંતિ ॥

**વર્ષ 2023ના લવાજમના નવા દર**

**ભારતમાં વાર્ષિક લવાજમ - રૂ. ૧૩૦.૦૦**

**આજુવન સભ્ય - રૂ. ૨,૨૦૦.૦૦**

**છુટક નકલ - રૂ. ૧૫.૦૦**

**વિદેશમાં વાર્ષિક લવાજમ - રૂ. ૧,૬૦૦.૦૦**

**આજુવન સભ્ય - રૂ. ૧૨,૦૦૦.૦૦**

- મૌન રહેવાથી શાંતિ અને શક્તિ મળે છે અને માનસિક અને શારીરિક આરામ પણ મેળવી શકીએ છીએ.
- જુવન સરળતાથી વહે તે માટે પાડોશી સાથેના સારા સંબંધો પણ જરૂરી છે. એ તમે સૌદેપ ચાદ રાખશો.
- કોણીને ક્ષમા કરો, દુશ્મનને પ્રેમ કરો બૂરું કરે તેની સાથે પણ ભલાઈ કરો.

## પ્રસંગ પરિમલ

### ઈશ્વરનું દ્યાન

એક ધર્મપરાયણ ત્રી હતી. એનું નામ પાર્વતી હતું. પોતાનું દરેક કામ તે ઈશ્વરને યાદ કરીને કરતી હતી. ગરીબોને મદદ કરવામાં તે હુંમેશાં આગળ રહેતી હતી. શક્ય હોય તેટલી તે દાનદક્ષિણા પણ આપતી હતી. પોતાના પતિને પણ તે ઈશ્વરનું નામ લેવા માટે કહેતી હતી તો તેનો પતિ કહેતો હતો કે વૃદ્ધાવસ્થામાં કુરસદથી ભગવાનનું દ્યાન કરીશ અને દાનદક્ષિણા આપીશ. આ વાત પર કચારે કચારે પાર્વતી અને તેના પતિ વચ્ચે વાદવિવાદ થતો હતો. એક દિવસે પાર્વતીએ એના પતિને ફરીથી કહ્યું, જુઓ, આપણને એ ખબર નથી કે આપણી જિંદગી કેટલા દિવસની છે. એટલે આપ ભગવાનની પૂજાદ્યાન વૃદ્ધાવસ્થામાં નહીં પણ જ્યારે સમય મળો ત્યારે કરો. આ સાંભળી પાર્વતીના પતિએ કહ્યું, ભગવાનની પૂજા દ્યાનમાં વ્યસ્ત રહીશ તો ઘર કોણ ચલાવશે? જો આપણી પાસે ધનસંપત્તિ નહીં હોય, તો કોઈ આપણો ભાવ નહીં પૂછે. જીવવા માટે ભૌતિક સાધનોની જરૂર પડે છે. તું હુંમેશાં ભગવાનનું નામ જ્પે છે તો શું ભગવાને કદી થાળી પીરસીને તારી સામે રાખી છે? કેટલાક દિવસો પછી પાર્વતીનો પતિ અચાનક બીમાર પડી ગયો. પાર્વતી એને લઈને વૈદ્યની પાસે ગઈ. વૈદ્ય એને સવાર, બપોર, સાંજ એમ ત્રણે સમયે આપવાની દવા આપી. પાર્વતીએ એ દવા છાજલી ઉપર મૂકી. સવારથી સાંજ થઈ ગઈ પણ પાર્વતીએ પોતાના પતિને દવા આપવાનું ભૂલી ગઈ છે. એણે દવા માગી તો પાર્વતી એ કહ્યું, ત્રણે સમયની દવા એકી સાથે લઈ લેશો. પતિને આ સાંભળી કોઈ આવી ગયો અને તે બોલ્યો, દવા

લેવાની પણ એક રીત છે એકી સાથે દવા પીવાથી બીમારી દૂર નહીં થાય. તે તો ખોરાકના હિસાબે ધીરે ધીરે પીવાથી દૂર થશે. પોતાના પતિની વાત સાંભળી પાર્વતી બોલી. આપે સાચું કહ્યું આપણે સૌ ભવરોગથી પીડિત છીએ. એના ઉપચાર માટે આપણે દરરોજ દવાના રૂપે ભગવાનનું સ્મરણ અને સત્કર્મ કરવું જોઈએ. રોગ વદી જવાથી ચા મૃત્યુ નજ્ઞક આવવાથી એકી સાથે દવા લેવાથી કોઈ લાભ નહીં થાય. પાર્વતીની વાતોથી પતિની આંખ ઉદ્ઘડી ગઈ. એ દિવસથી તે ભગવાનનું દ્યાન કરવા લાગ્યો અને પલ્લીની સાથે મળીને લોકોની સેવામાં જોડાઈ ગયો.

### સહિષ્ણુતા

ચીનના સમ્રાટના વડાપ્રદાન વૃદ્ધ બનતાં સેવામાંથી નિવૃત થઈ ગયા. એમનો પરિવાર ઘણો મોટો હતો. સમ્રાટે વિચાર્યુ વડાપ્રદાને લાંબા સમય સુદી રાજ્યને પોતાની સેવાઓ આપી છે. આજે પણ તેઓ પોતાના વિશાળ પરિવારને એકતામાં રાખી શક્યા છે. આવા અનુભવી માણસને મળવું જોઈએઓ. તેઓ સ્વયં ચાલીને વડાપ્રદાનના નિવાસે પહોંચ્યા. સમ્રાટને વડાપ્રદાનના ભવનનું વિશાળ આંગણું જોતાં આશ્રમ્ય થયું. તો વડાપ્રદાને કહ્યું રાજન! મોટો પરિવાર છે. એક હજાર સભ્યો છે. આ આંગણું એકી સાથે બેસીને ભોજન કરવા માટે છે. રાજએ ફરી ફરીને સમગ્ર ભવનનું અવલોકન કર્યું. ઘણી મોટી રસોઈ, એના પ્રમાણમાં વાસણ ભંડાર, સર્વ સભ્યોના શયનકક્ષ. સમ્રાટ વડાપ્રદાનના પરિવારની વ્યવસ્થા જોઈએ. આશ્રમ્યચિકિત થઈ ગયા. સમ્રાટે કહ્યું, વડાપ્રદાનશ્રી, આપના આટલા મોટા પરિવારની એકતાનું રહસ્ય શું છે? હું તે કારણ જાણવા ઈરછું

છું. વૃદ્ધ વડાપ્રધાન સમાટની વાત સાંભળીને કેટલીક પળો પછી એમણે પોતાના એક પુત્રને કાગળ અને પેન્સિલ લાવવાનો ઈશારો કર્યો. કાગળ આવી ગયો તો એણે લખવાનું શરૂ કર્યું. આખું પાણું લખીને સમાટના હાથમાં આયું. સમાટે એને વાંચ્યું. આખા પાનામાં માત્ર એક જ શાઢ સહિષ્ણુતા સો વખત લખવામાં આવ્યો હતો. બીજો કોઈ શાઢ નહોતો. વડાપ્રધાને દીરેથી કહ્યું સમાટ! અમારા પરિવારનો દરેક સભ્ય એકબીજાને સહન કરવાનું જાણે છે. જે બીજને સહન કરવાનું જાણે છે એનો સહવાસ સુખદ હોય છે.

### ત્રણ પ્રશ્ન

રાજ વિક્રમસિંહે એકવાર પોતાના દરબારીઓને ત્રણ પ્રશ્ન પૂછ્યા. દરબારીઓએ પોતાની સમજણ અનુસાર ઉત્તરો આવ્યા પણ રાજ કોઈનાથી સંતુષ્ટ થયો નહીં. રાજનો પહેલો પ્રશ્ન હતો વ્યક્તિઓમાં સર્વશ્રેષ્ઠ કોણ છે? બીજું સૌથી શ્રેષ્ઠ સમય કયો છે અને ત્રીજો પ્રશ્ન હતો સૌથી મોટું કર્મ કર્યું છે? એ પછી રાજ વિક્રમસિંહ દરબારમાં આવનાર દરેક વ્યક્તિને આ પ્રશ્ન પૂછ્યા પણ કોઈએ સંતોષજનક જવાબ આવ્યો નહીં. એક દિવસ રાજ પ્રશ્નોના ઉત્તરોની શોધમાં રાજ્યમાંથી નીકળી ગયો. તે જંગલમાં અહીં તહીં ભટકી રહ્યો હતો ત્યારે એને એક ગ્રૂપડી દેખાઈ. રાજ એ ગ્રૂપડીએ પહોંચ્યો. ત્યાં એક મહાત્મા છોડવાઓને પાણી પાઈ રહ્યા હતા. રાજને જોતાં જ છોડવાઓને પાણી પાવાનું બંધ કરીને રાજની પાસે આવ્યા અને એમને બેસાડીને ઠંડુ પાણી અને ફળ લઈ આવ્યા. ત્યારે એક વ્યક્તિ ત્યાં આવી જે ઘણી જ ધાયલ હતી. તે દર્દીથી પીડાઈ રહ્યો હતો. હવે મહાત્મા એ વ્યક્તિની સેવામાં લાગી ગયા. એમણે એ વ્યક્તિને સુવડાવી અનો ધા પર લેપ લગાવ્યો. પીડાથી બેહાલ વ્યક્તિના માથા પર

મહાત્મા હાથ ફેરવી રહ્યા હતા જેથી એને થોડી રાહત મળે. રાજ વિક્રમસિંહ આ બદ્યું ઘણા ધ્યાનથી જોઈ રહ્યા હતા. ત્યારે તે વ્યક્તિ આરામથી સૂઈ ગઈ તો રાજએ પોતાના ત્રણ પ્રશ્નો મહાત્માને પૂછ્યા. મહાત્મા બોલ્યા, રાજન, આપ અહીં આવ્યા ત્યાર પછી અત્યાર સુધી મેં જે કાર્ય કર્યા એમાં ત્રણ પ્રશ્નોના ઉત્તર છે. રાજએ કહ્યું કઈ રીતે? મહાત્મન હું સમજયો નહીં. મહાત્માએ સમજાવ્યું. જ્યારે આપ મારી ગ્રૂપડીમાં આવ્યા ત્યારે હું છોડવાઓને પાણી પાઈ રહ્યો હતો. તે મારું કર્તવ્ય હતું. પરંતુ તમે આવી ગયા. હું આપને અતિથિ સમજુ આપના સ્વાગતમાં જોડાઈ ગયો. ત્યારે તે ધાયલ વ્યક્તિ આવી ગઈ. હું અતિથિસેવાનું કર્તવ્ય છોડીને એની સેવા સારવારમાં જોડાઈ ગયો. એનું તાત્પર્ય એ છે કે જે પણ તમારી સેવા મેળવવા આવે તે એ સમયે સર્વશ્રેષ્ઠ મનુષ્ય છે. એની સેવા સર્વોત્તમ કર્મ છે. અને કોઈપણ કાર્ય કરવા માટે વર્તમાન જ સર્વોત્તમ સમય છે. એના સિવાય બીજો કોઈ સમય નથી.

॥ ઓમશાંતિ ॥

- રૂપની ઉપાસના કરતાં ગુણ અને પ્રેમની ઉપાસના વધુ શ્રેષ્ઠ છે. રૂપની વધુ પડતી આદત એવી છે કે તે કોઈ પણ ગુણવાન અને ચારિશ્યવાનને ઉંચે ચડવા હેતી નથી.
- એક નાના સરખા કાંકરાને પણ ઉંચે ઉડાડવો હોય તો મહેનત કરવી પડે છે, તો જીવન જેવા જીવનને ઉંચે ઉડાવવા માટે કશો જ શ્રમ નહીં? ના, જીવન આજે છે ત્યાંથી ઉપર ઉઠાવવા માટેનો સખત પુરુષાર્થ એ છે સાધના. જીવન જેવું છે ને જે ભૂમિકાએ ચાલે છે. એવું જ જીવાતું હોય તો એ જીવન જ નથી. જીવન એટલે જ વિકાસ.

# માણસને ગ્રહો નહીં, પૂર્વગ્રહો નડે છે. અપશુકન નહીં, અંદશ્રદ્ધા નડે છે.

## ભાતા રોહિત શાહ

એક હકીકત છે કે દરેક દેશની પ્રજા ખૂબ જ ભોળી છે. ભવ્ય કલ્પનાઓથી એને ભોળવી શકાય છે. મંત્રોનું મહિંત્વ બતાવી તેને મંત્રમુંઘ કરી શકાય છે. ચમલ્કારોના ચમલ્કાર બતાવીને ચેલાનાં ટોળેટોળાં ઊભા કરી શકાય છે. તમે કોઈ પણ જાતનું પ્રમાણ આપ્યા વગર પથ્થરનો એક ટુકડો કોઈને આપીને કહો, કે આ ચમલ્કારિક રલ્ય છે. તેના પ્રભાવથી તમારાં આધિ-વ્યાધિ-ઉપાધિ ટળી જશે. તો એ ફાલતું પથ્થર લેવાં, તમને મોં માંગી કિંમત ચૂકવનારાઓની લાંબી કતારો ખડકાઈ જશે. એટલું જ નહિં, એ પથ્થર ધેર લઈ ગયા પછી જો તેને નાનકડો પણ કોઈ લાભ થશે, તો તેને મહાચમલ્કાર જ માની લેશે અને જો એને કંઈ જ ફાયદો નહિં થાય તો પોતાના ગ્રહો અને ભાગ્યને દોષ જોશે.

જગતમાં જેટલા પણ વિશ્વ વ્યાપી મહાત્માઓ થયા છે, તેઓ આત્મશ્રદ્ધા, ઉત્સાહ, નિષ્ઠા અને પુરુષાર્થના માર્ગ આગળ વધીને જ થયા છે. કોઈ મહિાન વૈજ્ઞાનિક, મહિાન સાહિત્યકાર, મહિાન ડોક્ટરને મળીને પૂછશો, તો જવાબ મળશો કે તે સૌ મહાત્માઓ કદીય અંદશ્રદ્ધાથી ગ્રહો-મુહૂર્તો નડવાની વાત સ્વીકારતા નથી. જો તમે નીચે મુજબની સજ્જતા કેળવો તો તમને કદીય કોઈ ગ્રહ નહિં નડે. જગતની કોઈ શક્તિ તમારું અહિત નહિં કરી શકે.

- સતત સારી દિશામાં પરિશ્રમ કરો.
- પરિશ્રમ કરવા છતાં પરિણામ ન મળે તો

તરસ્થ રીતે પોતાની ભૂલ શોદો અને સુધારો.

- કોઈપણ પુરુષાર્થ ઉત્સાહથી જ કરો, વેચ સમજુને નહિં.
- તરત ફળ મેળવવાની વૃત્તિ ના રાખો, ધીરજ કેળવો.
- નવા વિચારો, નવા હેતુઓ, નવી પદ્ધતિઓ, નવા સાધનો વગેરે અપનાવતા રહો.
- મનમાં કોઈ જ શંકા ના રાખો. નિષ્ફળતાનો ભય ના રાખો.
- નિષ્ફળતા તમારી પરીક્ષા છે તેમ સમજે. નિષ્ફળતાની પળે હથિયાર હેઠાં મૂકી ના દેશો. હથિયારો મૂકી દેનાર પરાજ્ય જ પામે છે.
- કોઈની સાથે વિશ્વાસદ્યાત ના કરશો.
- પોતાની ભૂલ સ્વીકારવામાં નાનપ ના અનુભવો.
- એક ખાતરી રાખો કે તમને કોઈ ગ્રહ કે અપશુકન નડતા જ નથી. જો તમે અંદશ્રદ્ધા કેળવશો તો તમે પોતે જ તમને નડશો.
- જીવનમાં તડકો-છાંયડો, ચાડતી-પડતી, સુખ-દુઃખ તો આવે જ. એથી હતાશ થઈને મંત્ર -તંત્ર - રલ્ય - દોરા - ધાતા - તાજવીજનાં ધર્તીંગ કરવાની જરૂર નથી. તમે એવું કંઈ જ નહિં કરો તો પણ તમારા દુઃખના દિવસો ઝાગ્રો વખત ટકશો નહિં. સુખ હોય કે દુઃખ એક સરખા દિવસ કદીય કોઈના રહેતા નથી !

॥ ઓમશાંતિ ॥


# સંગમયુગની શબ્દાવલી

દેવી ભાઈઓ અને બહેનો,

## સંગમયુગની શબ્દાવલીના વિભાગમાં ઓક્ટોબર

- ૨૦૨૨ માસની શબ્દાવલી ભાગ - ૨૩ના જવાબો આ સાથે છે. જ્ઞાનના ચિંતનના આધારે આપના જવાબોને સાચા જવાબો સાથે સરખાવી શકશો. સંગમયુગની શબ્દાવલી ભાગ - ૨૪ અહીં પ્રસ્તુત છે. જેની આડી-ઉભી ચાવીઓ ભરશો. આપને આવતા ડિસેમ્બર - ૨૦૨૨ના અંકમાં શબ્દાવલી ભાગ - ૨૪ના જવાબો મળશે.

## સંગમયુગની શબ્દાવલી ભાગ - ૨૪



## શબ્દાવલી ભાગ - ૨૩ના જવાબોવાળું કોષ્ટક

૧	ન	૨	વ	૩	રા	૪	ત્રી	૫	લ	૬	મે	૭	ન્યુ				
૮	દ	૯	સ	૧૦	ન	૧૧	લ	૧૨	ક્ષમી	૧૩	ના	૧૪	રા	૧૫	ય	૧૬	એ
૧૭	દુ	૧૮	ગ	૧૯	ન	૨૦	જ	૨૧	પૂ	૨૨	ન	૨૩	ર	૨૪		૨૫	
૨૬	ગા	૨૭	ર	૨૮	જ	૨૯	ત	૩૦	ય	૩૧	યં	૩૨	તિ	૩૩		૩૪	
૩૫	દ્વા	૩૬	બ્રા	૩૭	ન	૩૮	બ્રા	૩૯	ન	૪૦	ન	૪૧	ન	૪૨	એ	૪૩	શ
૪૪	દ્વા	૪૫	દ્વા	૪૬	ન	૪૭	દ્વા	૪૮	દ્વા	૪૯	દ્વા	૫૦	દ્વા	૫૧	દ્વા	૫૨	દ્વા
૫૩	દ્વા	૫૪	દ્વા	૫૫	દ્વા	૫૬	દ્વા	૫૭	દ્વા	૫૮	દ્વા	૫૯	દ્વા	૬૦	દ્વા	૬૧	દ્વા
૬૪	દ્વા	૬૫	દ્વા	૬૬	દ્વા	૬૭	દ્વા	૬૮	દ્વા	૬૯	દ્વા	૭૦	દ્વા	૭૧	દ્વા	૭૨	દ્વા
૭૩	દ્વા	૭૪	દ્વા	૭૫	દ્વા	૭૬	દ્વા	૭૭	દ્વા	૭૮	દ્વા	૭૯	દ્વા	૮૦	દ્વા	૮૧	દ્વા

### આડી ચાવીઓ -

- ગુજરાતી વર્ષનો પ્રથમ મહિનો (૪)
- ‘ધા’પર ..... લગાવવામાં આવે (૩)
- ..... મે મગન (૩)
- ..... નો ઈવીલ (૩)
- ૧૭ નવેમ્બર ..... નો સ્મૃતિ દિવસ (૮)
- કોપી (૩)
- પણા (૩)
- દણિ (૩)
- ગુજરાતી કિરણ શબ્દનું હિન્દી અનુવાદ (૩)
- પંથ (૪)
- ..... દે ઈન્ડિયા (૨)
- ..... માતરમ્ (૨)
- સત્યના રાયણના પ્રસાદમાં ..... મળે (૨)
- પરિણામનું હિન્દી (૩)
- ..... બાબા (૨)
- હુંફાળું (૩)
- સીડી (૩)
- ‘કાળ’ શબ્દને ઉલ્ટો લખો (૨)
- રાત-દિવસને હિન્દીમાં ..... કહેવાય (૪)
- માં સરસ્વતીનું વાદ્ય (૩)

### ઉભી ચાવીઓ -

- સમય, અવધિ, કાળ (૪)
- નસ (૨)
- ચણે હે અપના ..... સબ સ્વાહા કરના હૈન (૬)
- જ્ઞાનની ભાષામાં આધારને શબ્દને ... કહેવાય (૩)
- ટેક્ટરની એક કંપની (૩)
- ‘આઇરિન્સ’ શબ્દને ઉંઘો લખો (૪)
- .... ચદા હી ધર્મસ્થય (૨)
- .... ચાકર (૩)
- સમાધાન (૨)
- એક દિવ્ય ગુણ (૫)
- તલાક (૪)
- જીત (૨)
- ‘રસોડાના વપરાશની ચીજવસ્તુઓ’નું અંગેજુ (૩)
- ૧લી નવેમ્બર .... દાઈનો સ્મૃતિ દિવસ (૫)
- એક સદગુણ (૫)
- પાણીનો સ્વભાવ (૩)
- મુખ (૩)



રાજકોટ કેવડાવાડીમાં ‘ત્રિકોણ બાગ કા રાજ ગાળેશ ઉત્સવ’ના આયોજુક ભાતા જુમ્મીભાઈને સૌંગાત આપતાં પ્ર.કુ. પાલબેન.



અમદાવાદ સુખશાંતિ ભવનમાં પધારેલ એથુ. કોરપોરેશન સ્ટેન્ડીંગ કમીટીના પૂર્વ ચેરમેનો ભાતા ધર્મન્દભાઈ શાહ અને ભાતા અમૃલભાઈ ભાઈ, BJPના સભ્યો સાથે પ્ર.કુ. નંદિનીબેન તથા પ્ર.કુ.જયશ્રીબેન.



અમરેલીમાં આયોજુત ‘ડોક્ટર્સ રેન્ફિલ્ડન’માં IMA પ્રમુખ ડૉ. જી.જાજેરા, રેડક્ષેસ સોસાયટીના ચેરમેન ડૉ. ભરત કાનાબાર, પ્ર.કુ. ગીતાબેન, પ્ર.કુ. કિંજલબેન તથા અન્ય.



ઉમરગામમાં આયોજુત આગાડીના અમૃત મહોત્સવ નિરંગા કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી ભાતા અક્ષયસિંહ રાજપુત, મામલતદાર ભાતા અમીતભાઈ ગડકીયા સાથે પ્ર.કુ. ચેતનાબેન, પ્ર.કુ. ઉમેશભાઈ.



જસદા સેવાકેન્દ્ર પર વરિષ્ઠ ગૃહિણી મહિલાઓનું સન્માન કર્યા બાદ સન્માનીત બઢેનો સાથે સમૂહદિશમાં પ્ર.કુ. ભાવનાબેન.



કચ્છ-મુદા ખાતે આગાડીના અમૃત મહોત્સવમાં અદાણી ફાઉન્ડેશન સાથે વૃક્ષારોપણ અભિયાનમાં પ્ર.કુ. સુરીલાબેન તથા પ્રભાવતલો.



સુરત જુઆવ ખાતે નવરાત્રીમાં આયોજુત ‘દેવીઓની જરૂરી’માં કોરપોરેટરો ભગિની મીનાક્ષીબેન, પીયુશાબેન, CA ભાતા લવકુશભાઈ, પ્ર.કુ. રંજનાબેન, પ્ર.કુ. મીનાક્ષીબેન.



વાપીમાં ટ્રાન્સપોર્ટ પ્રભાગ દ્વારા આયોજુત ‘સર્ડક સુરક્ષા મોટર સાયકલ યાત્રા’ જાગૃતિ અભિયાનમાં સંદેશ આપતાં પ્ર.કુ. રશીમબેન તથા યમદૂતના પાત્ર સાથે અન્ય મહાનુભાવો અને પ્ર.કુ. કુંતીબેન.



અમદાવાદમાં ખુશરાજુ વૃદ્ધાશ્રમનું શુભ ઉદ્ઘાટન કરતાં મુખ્ય પ્રશાસિકા આદરણીય રાજ્યોગિની દાદી રતનમોહિનીજી, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ભગિની ડૉ. નિમાબેન આચાર્ય, ગુજરાત ઐન સંચાલિકા રાજ્યોગિની ભારતીદીદી, બ્ર.કુ. ચંદ્રકાબેન, બ્ર.કુ. કૈલાસબેન, કાર્યકર્મમાં દાદીજી સાથે કેકકટીંગ વિધિમાં ભગિની ડૉ. નિમાબેન, આદરણીય ભારતીદીદી, બ્ર.કુ. કૈલાસબેન, બ્ર.કુ. લલિતભાઈ, બ્ર.કુ. લીલાબેન, બ્ર.કુ. નેહાબેન, બ્ર.કુ. દીપિતાબેન.



ગાંધીનગરમાં ગુજરાતના મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવપ્રતનની શુભેચ્છા મુલાકાત બાદ ઈશ્વરીય નિમંત્રણ આપતાં બ્ર.કુ. કૈલાસબેન સાથે બ્ર.કુ. તારાબેન.



ગાંધીનગર સેક્ટર૨-૩ ખાતે સમસ્ત ગુજરાત વણગારા સમાજના મહાસંમેલનનું ઉદ્ઘાટન કરતાં ગુજરાતના મુખ્યમંત્રી ભાતા ભૂપેન્દ્રભાઈ પટેલ, બ્ર.કુ. નેહાબેન, વણગારા સમાજ ગુજરાતના પ્રમુખ ગોવિદજી વણગારા સાથે બ્ર.કુ. સુનિતાબેન તથા અન્ય.



સુરત ખાતે ગણેશ મહોત્સવમાં પધારેલ ગુજરાતના મુખ્યમંત્રી ભાતા ભૂપેન્દ્રભાઈ પટેલને શુભેચ્છા બાદ ઈશ્વરીય સૌગાંડ આપતાં બ્ર.કુ. કવિતાબેન તથા બ્ર.કુ. અનિધાબેન.



અમદાવાદ વસ્ત્રાલ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોરપોરેશન દ્વારા ગુજરાતના પૂર્વ ગુહભંગી અને ધારાસંભ્ય ભાતા પ્રીતિપસ્નિ જાડેલા પ્રજાપિતા બ્રહ્માકુમારી માર્ગનું નામાભિધાન બાદ ઈશ્વરીય સૌગાત આપતાં બ્ર.કુ. ઉધાબેન, બ્ર.કુ. કોંકિલાબેન.